

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ

શ્રી તારાચંદ ધનજીભાઈ મહેતા કાર્યાલય,
૪, દેવકરણ મેન્શન, બિલ્ડિંગ નં. ૭, બીજે માળે,
૨૪, વિહલદાસ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨
ફોન : ૦૨૨-૨૨૦૬૯૧૭૨

સમય : બપોરે ૧-૦૦થી સાંજે ૬-૦૦ (1.00 pm to 6.00 pm)
Email : svjainsamajmumbai2@gmail.com
svjainsamajmumbai

તંત્રી : શ્રીમતી કીર્તિબેન મયુરભાઈ મહેતા
મો. ૯૨૨૪૭૭૧૨૩૮
સહતંત્રી : શ્રી નિખીલ કિશોરકુમાર શાહ
મો. ૯૬૧૯૬૧૯૯૯૭

સમાજની કારોબારી સમિતિ

શ્રી મહેશભાઈ મથુરાદાસ સાવરીયા ----- પ્રમુખ
શ્રી ગિરીશભાઈ કાંતિલાલ પારેખ ----- ત.ભ. પ્રમુખ
શ્રી ગુણવંતભાઈ વૃજલાલ મહેતા ----- ઉપ-પ્રમુખ
શ્રી મયુરભાઈ નગીનદાસ મહેતા ----- માનદ્ મંત્રી
શ્રી દીક્ષિતભાઈ નટવરલાલ માઝની ----- માનદ્ સહમંત્રી
શ્રી આશિષભાઈ વિનોદરાય મહેતા ----- માનદ્ ખજાનચી
શ્રી જયંતભાઈ ચુનિલાલ દોશી ----- માનદ્ સહખજાનચી
શ્રી અનિલભાઈ ગુલાબચંદ મહેતા ----- સભ્ય
શ્રી અશોકભાઈ દલિચંદ ભણશાલી ----- સભ્ય
શ્રી નિખીલભાઈ કિશોરકુમાર શાહ ----- સભ્ય
શ્રી પિયુષભાઈ હરકિશનદાસ શાહ ----- સભ્ય
શ્રી રાજેન્દ્રભાઈ ઓત્તમચંદ પુનાતર ----- સભ્ય
શ્રી સંજયભાઈ ધનસુખલાલ મહેતા ----- સભ્ય
શ્રી યોગેશભાઈ વિનોદરાય વોરા ----- સભ્ય
શ્રીમતી નીતાબેન પરેશભાઈ શેઠ ----- કો. ઓપ્ટ સભ્ય
શ્રીમતી દીપ્તિબેન દીક્ષિતભાઈ માઝની ----- કો. ઓપ્ટ. સભ્ય

સલાહકાર સમિતિ

શ્રી શ્રીકાંતભાઈ સાકરચંદ વસા - શ્રી પ્રવીણભાઈ હિંમતલાલ સંઘવી
શ્રી મહેન્દ્રભાઈ ઓતમચંદ પુનાતર - શ્રી પરેશભાઈ મણીલાલ શેઠ

BANK DETAILS:

Name : SHRI SORATH VISA SHRIMALI JAIN SAMAJ
BANKER : Bank of Baroda, J. J. Market, Mumbai-3
S. B. A/c No. 03870100000044
IFSC : BARBOBULLIO MICR : 40012047

Name : SORATH VISA SHRIMALI JAIN SAMAJ TRUST
BANKER: UNION BANK OF INDIA
Princess Street, Mumbai - 400 002
S.B.A/c. No. 319102010054364
IFSC : UBIN0531910

કાનૂની કાર્યક્ષેત્ર મુંબઈનું રહેશે

લવાજમના દરો ભારતમાં
વાર્ષિક : રૂ. ૧૦૦/- આજીવન રૂ. ૧૫૦૦/-
પરદેશમાં (ફક્ત વાર્ષિક) : U.S. 20 Yearly

મુદ્રણ અને પોસ્ટિંગ અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ-નીતિનભાઈ બદાણી
સાઈબાબા નગર, ૩૧૦ ત્રિકાલ બિલ્ડિંગની પાછળ, નાપડુ કોલોની પાસે,
પંતનગર, ઘાટકોપર (ઈ), મુંબઈ-૭૫ ફોન : ૯૨૨૩૪૩૦૪૧૫



શ્રી સોરઠ વિશાશ્રીમાળી

અંક - ૨ ૦ વર્ષ : ૪૮ ૦ માર્ચ ૨૦૨૦ ૦ મૂલ્ય રૂ. ૮

મા બહુ ખોટું બોલે છે

સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા.

રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે.

તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઈ લે. મને ભૂખ નથી.

મા બહુ ખોટું બોલે છે.

મને મોડું થાય તો જાગ્યા કરે છે ને ઠપકો આપું તો કહે છે, એ તો મને ઊંઘ આવતી ન હતી.

મા બહુ ખોટું બોલે છે.

હું ન હોઉં ત્યારે મને ભાવતું કંઈ તેનાથી બનતું નથી. કહે છે, આજકાલ બજારમાં મળતું નથી.

બેચાર રોટલી આપું છું કહી એ મને મોટું ટિક્કિન પકડાવે છે.

કંઈ નથી મુક્તી કહી મારી બેગમાં મને ભાવતાં અઘાણાંની બોટલ છાનીમાની મૂકી દે છે.

મા બહુ ખોટું બોલે છે.

ત્રણ કલાક થિયેટરમાં મારાથી બેસાતું નથી. બહારના તેલમસાલા મને સદતાં નથી.

આટલી સાડીઓ તો પડી છે કહી પોતાનો ખર્ચ ટાળે છે.

મને સારું છે કહી ઓશિકામાં મોં છૂપાવી ખાંસી લે છે.

મા બહુ ખોટું બોલે છે.

મારી ખામીઓને બધાથી છૂપાવી લે છે. મારી પ્રાપ્તિને વધારીને વર્ણવે છે. કહે છે, મારા જેવું સુંદર ને બુદ્ધિશાળી કોઈ નથી.

મારા માટે વ્રત ઉપવાસ કર્યા કરે છે પણ કહે છે કે એ તો હું ભગવાન માટે કરું છું.

મારી દુનિયામાં હું તેને ભૂલી જાઉં તો મીઠું હસી લે છે

મા બહુ ખોટું બોલે છે.

(સાભાર: સુન'રી)



મારા પ્રિય વાચકમિત્રો અને આદરણીય વડીલબંધુઓ
આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર.

આ લેખ લખી રહી છું, ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે એનું વર્ચસ્વ બતાવી દીધું છે. એની સામે કાળજીનાં કયા પગલાં લેવા એની તો બધાને ખબર છે, પણ એક વસ્તુ સમજવાની છે. કુદરતની સામે આપણી બુદ્ધિ, શક્તિ બધું જ બેકાર છે. કુદરતની એને જે કરવું હોય તે કરીને જ રહે છે. તો પછી મનુષ્યને શેનું ગુમાન થાય છે કે હું સર્વસ્વ છું.

હરિવંશરાય બચ્ચને એક કાવ્યમાં લખ્યું છે કે “જીસે જીવનमें श्रद्धा है उसे उस की अपूर्णता में भी श्रद्धा होनी चाहिए. अपूर्णता का स्वीकार किये बिना हम जिंदगी का आनंद नहीं ले सकते” પ્રકૃતિની કોઈપણ વસ્તુ પૂર્ણ નથી, ધરતી પ્યાસી છે, પણ એની પ્યાસ મિટાવવા માટે વરસાદ આવે છે એ પણ પૂર્ણ નથી.

પતિ-પત્ની, બે મિત્રો કે પછી કોઈ બે વચ્ચેના સબંધોમાં ઘર્ષણ તો આવવાનું જ છે, કારણ કે કોઈપણ વ્યક્તિ પૂર્ણ નથી, ૨૪ કલાકના એકમમાં દિવસનો અર્ધો ભાગ પ્રકાશથી ઝળહળતો છે. તે તમારાં તન-મનમાં ઉત્સાહ ભરી કાર્ય કરવાની ચેતના ભરે છે. બીજો ભાગ અંધકાર છે, જે તમારી શ્રમિત કાયાને શાંતિથી પોતાની ગોદમાં લઈ પોઢાડી દે છે જેથી તમે બીજા દિવસે ઉત્સાહથી ફરી કાર્ય કરી શકો. જીવનમાં શ્રમ અને વિશ્રામ બન્નેની સરખી જરૂર છે.

આપણે જીવનયાત્રાના પ્રવાસે સાથીની પસંદગી કરવામાં સંપૂર્ણતાનો આગ્રહ સેવતા હોઈએ તો આપણે પોતે પણ સંપૂર્ણ નથી તેનો સ્વીકાર કરીને આગળ વધવું પડે છે. સામું પાત્ર કદી જ આદર્શ કે સંપૂર્ણ છે એમ માની લેવું નહીં. જો પસંદગી કરતી વખતે સામા પાત્રની અપૂર્ણતાનો પૂરેપૂરો ખ્યાલ હોય તો બન્ને જણ સુખી થાય છે. બે અપૂર્ણ જીવો ભેગા થાય ત્યારે જ એક સંપૂર્ણ સંસાર ઊભો થાય છે.

K. M. Mehta

૧૧મી પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ



સ્વ. ધીરજલાલ ચંદુલાલ માઝની

સ્વર્ગવાસ : તા. ૨૧-૩-૨૦૦૯, ફાગણ વદ ૧૦

“તમે ધૂપસળી જેવું જીવન જીવી ગયા,
સુગંધ જેની ચોતરફ મૂકતા ગયા.”

આપના આત્માને પરમકૃપાળુ પરમાત્મા
પરમશાંતિ આપે તેમ જ આપના આશીર્વાદ હંમેશ
અમારી સાથે રહે એવી અમારી
અંતઃકરણપૂર્વકની પ્રાર્થના... !!!

લિ.

ધર્મપત્ની : લીલમબેન
પુત્ર : હરેશ, નરેશ
પુત્રવધૂ : હીના, વૈશાખી
પુત્રી-જમાઈ : કલ્પના અમિતકુમાર મોદી
પૌત્ર : હેમીત, જૈનીલ

તથા

સમસ્ત માઝની પરિવાર

જીવન સરળ કે વમળ??

■ પૂજા મહેતા

આ વાર્તા છે એક સામાન્ય સ્ત્રીની, જેમણે મારા દૃઢ્યને અસામાન્ય રીતે સ્પર્શ્યું.

હું એમને એક આશ્રમ (વૃદ્ધાશ્રમ)માં મળી. વૃદ્ધાવસ્થાને કારણે એ લાકડીના સહારે ચાલતાં હતાં પણ એ ચાલ નબળી નહતી. એમાં પડી જવાનો ડર તો બિલકુલ ન હતો.

ખબર નહીં શું, પણ કંઈક અલગ હતું એમનામાં, જે આપમેળે અને અનાયાસે મને આકર્ષિત કરતું અને એ કુતૂહલ દૂર કરવા મેં એમનાં જીવન વિષે જાણવાનો પ્રયાસ કર્યો. હકીકત જાણીને મારું કુતૂહલ બમણું થઈ ગયું. આ સ્ત્રી પચીસ લોકોનો પરિવાર છોડી, અહીં એકલું જીવન ગાળતી હતી... હા... એ પણ સ્વેચ્છાએ...

“આટલો મોટો પરિવારનો માળો છોડી શા માટે અહીં સાવ એકલવાયું જીવન જીવવાનું?” મારું કુતૂહલ અને એમનું અસાધારણ જીવન, આ બન્ને મને એમની તરફ ખેંચી ગયાં.

એક સવારે, મેં એમને વૃક્ષની નીચે બેસીને કંઈક કરતાં જોયા. એટલે હું ત્યાં ગઈ તો એક જૂની પેનને સેલોટેપથી રિપેર કરી રહ્યાં હતાં. મેં ઈશારાથી કાતર માગી અને સેલોટેપ કાપી આપી. એમણે પેન પર લગાડી. પેન અને ટેપ એમનાં પોતાના ઝોળામાં નાખી ચાલતા થયાં. મેં એમને આન્ટી કહીને બોલાવ્યા અને કહ્યું હવે “તમને અહીં ગમે છે?”

મારા મોઢેથી કોણ જાણે કેમ પણ આ શબ્દો સરી પડ્યા. એ થોડુંક ફર્યા, નાનકડું **Smile** આપ્યું અને કંઈ પણ બોલ્યાં વગર ધીમે પગલે જતા રહ્યાં, અને હું એ જ વૃક્ષની નીચે કંઈક ખોવાયેલું મળ્યું હોવાની મીઠા આનંદ સાથે નિ:શબ્દ ઊભી રહી ગઈ.

કદાચ આજે એક સ્ત્રી “મારી આન્ટી” બની’તી એટલે? અહીં આશ્રમમાં સવાર “મારી આન્ટી”ના સુમધુર કંઠ અને પ્રાર્થનાની પવિત્રતાથી થાય છે. રોજ એમનાં આ

સ્વરોમાં મને મીઠાશ વર્તાતી અને આજે આત્મીયતા પણ વર્તાઈ.

હું એમની નજીક આવવા લાગી હતી.

વાતો, મજાક, ટાઈમપાસ અને જોર જોરથી હસવાનું **Routine** થઈ ગયું... અને હા આન્ટીની **Sense of humour** એકદમ **Amazing** હતી. આ સમય મારા માટે આશ્રમ પરનો **Best** સમય હતો.

એક રાત્રે બહુ વરસાદ હતો, હું એમનાં **Room**માં જ બેઠી’તી. મારી **Feelings** અને **Emotions** મારી **Life** અને **challenges**, શું મને ખુશ કરે અને શું દુ:ખી, આ બધું આકાશથી ટપટપ પડતાં ટીપાંઓની જેમ મારા મુખેથી પડવા લાગ્યું. મન ખોલીને મેં બકવાસ કરી અને એક માની જેમ એ સાંભળતાં ગયાં.

એ કંઈક બોલ્યાં, “મારો પરિવાર છે પચીસ લોકોનો. કદાચ એકાદુ વધ્યું પણ હશે.”

પહેલીવાર એમણે “પરિવાર”નું નામ લીધું.

એ વિધવા છે... ત્રણ દીકરા અને બે દીકરીઓ... બધા પરણિત છે... કોઈ કામમાં **Busy** તો કોઈ ધંધામાં વ્યસ્ત... કોઈ પરિવારમાં રચ્યાપચ્યા તો કોઈ બાળકો પાછળ... કોઈકને જવાબદારી લેવી નથી તો કંઈ લઈ શકે એમ નથી... અને આ લાચારીભર્યું જીવન આન્ટી જીરવી ન શક્યા અને ભગવાનને પ્રાર્થના કરતા કે કંઈક રસ્તો દેખાડો.

એક દિવસ માર્કેટમાં એમની એક જૂની **friend** મળી ગઈ અને એના દ્વારા માહિતી મળી કે કોઈક એક આશ્રમમાં એક સારી **singer**ની જરૂર છે.

આન્ટી દોડીને ઘરે ગયાં, પોતાની **bag pack** કરી અને ઘરના દરેકેદરેક **members**ને તાબડતોબ બોલાવ્યા, અને પોતાનું **decision** સંભળાવ્યું.

સભ્યોના દરેક નાટક **melodrama face** કર્યા છતાં

૨૦મી પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન-સ્મૃતિવંદના



સ્વ. લાભકુંવરબેન ભગવાનજી મહેતા

સ્વર્ગવાસ: ફાગણ સુદ - ૧, મંગળવાર, તા. ૭-૩-૨૦૦૦

સુખને છલકાવ્યું નહિ, દુઃખને દેખાડ્યું નહિ, હસતો રાખી ચહેરો.

માતાપિતા બની હિંમત, વહાલ અને હૂંફ આપી અમારા જીવનનું ઘડતર કર્યું.

કાયમી લીધી વિદાય અને મૃત્યુને કર્યું અમર. વર્ષો વીતી ગયાં પણ તમો

અમારા વિચારોમાં, શબ્દોમાં, કાર્યોમાં અને અમારા આનંદમાં હજી પણ જીવંત છો.

અમારી ઉન્નતિ, પ્રગતિ અને સુખ-શાંતિ માટે અમે આપના ઋણી છીએ.

હે પરમકૃપાળુ પરમાત્મા, સદ્ગતના આત્માને શાશ્વત સુખ અને

પરમશાંતિ અર્પો એવી અમારા સહપરિવારની પ્રાર્થના.

આપને અમારા સર્વેની હૃદયપૂર્વક ભાવાંજલિ...

પુત્ર-પુત્રવધૂ : વિનોદ-નયના,

પુત્ર-પૌત્રવધૂ : આશિષ-ચાંદની

દીકરી-જમાઈ : સોનલ-વિશાલ

પ્રપૌત્રી-પ્રપૌત્ર : વિયોના, માહિત

દોહિત્ર : કિશ

તેમ જ

સમસ્ત મહેતા પરિવાર

સૌજન્ય : Elegance Realty, Borivali, Mumbai

firmly ઘર છોડવાના નિર્ણય પર અડગ રહ્યાં... કોઈ ચિંતા કે ડર વગર બધાને આશીર્વાદ આપી નીકળી ગયાં.

આશ્રમ પહોંચી ગાવાની ટેસ્ટ આપી અને પાસ થઈ ગયાં. ટેસ્ટ લેનાર મહિલાએ આન્ટીને **Job**થી શું અપેક્ષા છે એમ પૂછ્યું. આન્ટી હસીને બોલ્યા “ફક્ત અને ફક્ત એક છત. ક્યાંય પણ... કેવી પણ...”

અને એ દિવસથી આન્ટી અહીં જ રહે છે.

આ બધું સાંભળીને મારા આંસુઓનો બંધ તૂટી ગયો પણ આન્ટી એકદમ સ્વસ્થ હતાં. મુખ પર **smile** હતું અને **confidence** સાથે બોલ્યાં, “હું પહેલાથી બહેતર જીવન જીવી રહી છું અને આજે, જો તું મળી ગઈ. જીવનનાં સફરનું આ કેટલું સરસ સ્ટેશન છે.

છે ને મારી સફર એકદમ મજાની...!! મેં માથું હકારમાં ધુણાવ્યું અને એમને ગળે મળી. આન્ટી ફરી બોલ્યા, “મારી આ સફરમાં હું આતુરતાથી નીતનવાં

સ્ટેશનોની રાહ જોઉં છું અને જે **stop** આવે એને દિલથી માણું છું...

સહજતા અને સુંદરતાથી બે જ વાક્યોમાં એમણે દરેકની **life** નો સાર કહી દીધો.

કેટલાંક સ્ટેશનોથી પ્રેમ થાય પણ હંમેશા ત્યાં ન રહેવાય...

કેટલાંક સ્ટેશનો ફરજિયાત હોય... જવાબદારીઓનાં સ્ટેશન... એટલે ત્યાં **red signal** છે, થોભવું જ પડે... પણ અટકી ન જવાય **green signal** સુધી ખમીને પછી ફરી સફર શરૂ કરાય...

કેટલાંક સ્ટેશન **Avoid** કરવા પડે અને કેટલાંક **ignore**. આવા સ્ટેશનો પર રોકાવાય નહીં બસ નીકળી જવાય.

આ છે જીવન સફર...

જો અટકો નહીં તો સરળ છે,

ને અટકી ગયાં તો વમળ છે...!!!

જોઈએ છે ઑફિસ ક્લાર્ક

પાર્ટ ટાઈમ કામ માટે આ સાથે જણાવ્યા મુજબની

જાણકાર વ્યક્તિ જોઈએ છે.

અભ્યાસ : **H.S.C. (Minimum)**

અનુભવ : **Microsoft Office**

(Word, Excel, Power Point)

ઉંમર: ૨૫ વર્ષ - ૪૫ વર્ષ

કામનો સમય: ૧-૦૦થી ૬-૦૦ સાંજે

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ

સ્થળ: દેવકરણ મેનશન,

કાલબાદેવી, મુંબઈ - ૪૦૦ ૦૦૨.

સંપર્ક: ૯૮૨૦૮૦૮૬૪૪

CONGRATULATIONS CERTIFIED FINANCIAL TECHNICIAN



Name : Jigar Haresh Mehta

Address : A-2 307, Nirmal Shopping Centre, Opp. Railway Station, Nallasopara, (East)

Degree : **Certified Financial Technician (CFTe)**
Chartered Market Technician
(CMT, USA) Mob. No. 9820203430



શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજ મુંબઈ

સભ્યોની વિગતો ભરવા માટે જરૂરી જાણકારીઓ

સભ્યો "Member Details" ફોર્મ નીચે જણાવેલ કોઈપણ એક માધ્યમ દ્વારા ભરી શકાશે.

૧. ઓનલાઈન : વેબસાઈટ www.svjainsamaj.com દ્વારા.
૨. વોટ્સઅપ : + ૯૧-૯૩૭૨૧૧૮૪૧૭
૩. મુખપત્ર : મુખપત્રમાં છપાયેલ ફોર્મ ભરી સમાજના કાર્યલય પર મોકલી શકો છો.
૪. ઈમેઈલ : સંપૂર્ણ ફોર્મ ભરી data@svjainsamaj.com પર ઈમેઈલ કરી શકો છો.

સભ્યોની વિગતો ઓનલાઈન ભરવા માટે માહિતી

૧. ઓનલાઈન : વેબસાઈટ www.svjainsamaj.com પર જાવ.
૨. "New User ? Register Here" link ઉપર ક્લિક કરો.
૩. 'Details of Head of the Family નું એક ફોર્મ આવશે.
૪. આ ફોર્મમાં "*" (asterisks) દર્શાવેલ બધી જ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. આ વિગતો વગર ફોર્મ સ્વીકારવામાં નહીં આવે.
૫. મોબાઈલ નંબર અને ઈમેઈલ તે જ ભરવા કે જે તમે સરળતાથી જોઈ શકો. Activation Link / OTP આ જ મોબાઈલ નંબર / ઈમેઈલ ઉપર મોકલાવવામાં આવશે.
૬. ફોર્મના અંતમાં એક Verification code (CAPTCHA) હશે, તે પણ ભરવાનું રહેશે.
૭. બધી વિગતો બરાબર ભર્યા પછી 'SUBMIT' બટન ઉપર ક્લિક કરો.
૮. ફોર્મ SUBMIT થયા પછી સભ્યને, ફોર્મમાં ભરેલ ઈમેઈલ ઉપર, એક Activation link આવશે. આ ઈમેઈલમાં Head of the Family ની Username અને Password પણ હશે.
૯. આ Activation link ઉપર ક્લિક કર્યા બાદ તે સભ્યનો account વેબસાઈટ પર કાર્યરત થશે
૧૦. પછી તે સભ્ય 'Member Login link ઉપર ક્લિક કરીને Login કરી શકશે.
૧૧. Login કર્યા બાદ, સભ્યએ કુટુંબના એક વ્યક્તિગત સભ્ય તરીકે પણ એની વિગતો ભરવાની રહેશે. આ વિગતોની હેઠળ આપેલા ફોર્મમાં ભરવાની રહેશે. તે ઉપરાંત કુટુંબના અન્ય સભ્યોની વિગતો પણ અહીં ભરવાની રહેશે.
૧૨. દરેક સભ્યો આ બધી વિગતો પછીથી વેબસાઈટ પર બદલી શકશે.

જરૂરી સૂચનાઓ

- ☛ કુટુંબના Head of the family ની બદલીમાં કુટુંબની કોઈ પણ એક વ્યક્તિ Username અને Password બનાવી શકે છે.
- ☛ નવા સભ્ય એટલે કે Head of the family (જેમણે 'New Number' registration કર્યું છે વેબસાઈટ પર), તેમણે કુટુંબના એક વ્યક્તિગત સભ્ય તરીકે પણ એની વિગતો ભરવાની રહેશે.
- ☛ તમારો Username અને Password કોઈપણ અણજાણ વ્યક્તિને નહીં આપવો.
- ☛ ભારતમાં તથા વિદેશમાં સ્થાયી સોરઠ જૈન સમાજનો કોઈપણ સભ્ય Member Details ફોર્મ ભરી શકે છે.
- ☛ બધી જ વિગતો બરાબર ભરજો જેથી કરીને વેબસાઈટ ઉપર વિગતો બરાબર દેખાય.
- ☛ સોરઠ જૈન સમાજના કોઈપણ એક સભ્યનો reference આપો જેથી વિગતો Verify કરી શકાય.
- ☛ ફોર્મ ભર્યા પછી verification કરવામાં આવશે.

શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજ, મુંબઈ - શ્રી તારાચંદ ધનજીભાઈ મહેતા કાર્યાલય,
દેવકરન મેન્સન, બ્લોક નં. ૭, બીજે માળે, વિહુલદાસ રોડ, મુંબઈ - ૪૦૦૦૦૨. ઈન્ડિયા.

T.: +91-22-22069172 M: + 91-9372118417 E: data@svjainsamaj.com W: www.svjainsamaj.com

મજેવડીના શ્રી શાંતિનાથ દાદા જીનાલયની સંવત ૨૦૭૬માં ૫૩મી સાલગ્રેહ

મજેવડી નગરે શ્રી શાંતિનાથજી જીનાલયની ૫૩મી સાલગ્રેહ ધ્વજા આરોહણ સં. ૨૦૭૬ વૈશાખ વદ-૩ રવિવાર તા. ૧૦ મે ૨૦૨૦ના શુભ દિવસે મજેવડી મુકામે ઉજવાશે. આ મહામુલા પવિત્ર પ્રસંગે મજેવડીના વતનીઓ, બહેન-દીકરીઓ તથા સગાસંબંધીઓ સ્નેહીજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

અત્યારસુધી અનેક પરિવારોએ વર્ષગાંઠનાં લાભાર્થી તરીકે લાભ લીધેલ છે. ખૂબ જ ધામધૂમથી વર્ષગાંઠની ઉજવણી થાય છે. આ વરસથી દરેક પરિવારોને દર વરસે લાભ મળે અને વર્ષગાંઠ પ્રસંગે પરિવારોની હાજરી રહે એવા આગ્રહથી પરિવાર દીઠ માત્ર રૂ. ૨૫૦૦/- (રૂ. બે હજાર પાંચસો) દર વરસે એમ પાંચ વરસ સુધી ૫૦ પરિવારોના નામ જોઈએ છે, જેમાં ૨૦ નામ આવી ચૂક્યા છે. જે ભાગ્યશાળી પરિવારને લાભ લેવાની ઈચ્છા હોય તે નીચે જણાવેલ કોઈપણ કાર્યકરભાઈને મોબાઈલ ઉપર નામ લખાવી શકશે.

લી. શ્રી શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ - મજેવડી
શ્રી શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ - મજેવડી ટ્રસ્ટી મંડળ

કિશોરભાઈ લાલચંદ રામાણી	૯૩૨૧૯૮૮૩૭૩
નીતિનભાઈ નાગરદાસ ઓધવાણી	૯૩૨૪૬૯૨૦૯૫
હરેશભાઈ વિનયચંદ મહેતા	૯૮૨૦૨૦૩૪૩૦
પ્રવીણભાઈ અમૃતલાલ મહેતા	૯૮૭૯૬૭૪૭૮૪

વિપુલભાઈ પાનાચંદ શાહ
અશોકભાઈ મનુભાઈ ખીબોસીયા
કાન્તિભાઈ વલ્લભદાસ મહેતા
મિતેષભાઈ નાગરદાસ મહેતા

પુણ્યતિથિએ ભાવપૂર્વક ઠાઠિક શ્રદ્ધાંજલિ



છોડવડી (સોરઠ) નિવાસી સ્વ. શ્રી કાન્તીલાલ કપુરચંદ મહેતા

સ્વર્ગવાસ તા. ૧૪/૨/૨૦૧૧

જીવનમાં સુવાસ, પ્રભુમાં વિશ્વાસ, આંખમાં અમી, દરિયા જેવું દિલ, મીઠી વાણી, સ્નેહની સરવાણી, સરળ અને મિલનસાર સ્વભાવ, વ્યવહારિક સુઝ અને બીજાને ઉપયોગી જીવવાની ભાવનાવાળા, સુખને છલકાવ્યું નહિ, દુઃખને ટેખાડ્યું નહિ, હસ્તો રાખી ચહેરો, કાયમની લીધી વિદાય અને મૃત્યુને કર્યું અમર. પૈસો આપતાં બધું ખરીદી શકાશે પણ પિતાનું વાત્સલ્ય અને પ્રેમ ખરીદી શકાતો નથી.

હે પરમ કૃપાળુ પરમાત્મા, સદ્ગત આત્માને શાશ્વત સુખ અને પરમ શાંતિ અર્પે એવી અમારા સહ પરિવારની પ્રાર્થના..

તમે આવ્યા અમારા જીવનમાં, ઘુપછડી બની, સર્વત્ર મહેંકી યાદ તમારી આવતાં, આંખલડી છલકાય છે, જોઈ તસ્વીર તમારી, ઉઠવા આંસુ ઉભરાય છે.

તમારો પ્રેમાળ પરિવાર..

ધર્મપત્નિ	:- મંજુલાબેન કાન્તીલાલ મહેતા
પુત્ર-પુત્રવધુ	:- માયા જીતેન્દ્ર મહેતા / હર્ષા ભરત મહેતા / દિપા પરાગ મહેતા
પુત્રી-જમાઈ	:- મીના હર્ષદરાય વારીયા / હર્ષા પ્રદીપકુમાર મહેતા / નયના કુમાર એચર
પૌત્ર-પૌત્રવધુ	:- ઉર્વી કેજલ મહેતા / નિકિતા પારસ મહેતા
પૌત્ર	:- ઋષભ, વિરલ, વિશાલ, સૂરજ, વિજય, મયુર
પૌત્રી	:- હિરલ, દેવાંશી, હિલોની, કૃપા, રીટા, નેહા
પપૌત્રી -પુત્ર	:- હસ્તી, હિયાંસ

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન મહિલા મંડળ - બોરીવલી



વર્ષનો પ્રથમ પ્રોગ્રામ:-

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન મહિલા મંડળ બોરીવલીએ ૨૩મા વર્ષમાં પદાર્પણ કર્યું તે નિમિત્તે મંડળના પ્રમુખ શ્રીમતી તુલાબેન કમલેશભાઈ મહેતા તથા કમિટીએ આવતા ૩ વર્ષ માટે મહિલા મંડળનો કાર્યભાર સંભાળતાં આ પ્રથમ પ્રોગ્રામનું આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યું હતું.

આ સમારોહનું આયોજન તા. ૨૭.૨.૨૦૨૦ ગુરુવારના રોજ બપોરે ૨ કલાકે ન્યુ શાંતિ નગર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આવતા ત્રણ વર્ષ માટે મેમ્બર બેનોને નવા આઈ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

શ્રી વિકાસભાઈ પટેલને ગેમ રમાડવા તથા સ્ટેન્ડ અપ કોમેડી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મંડળના બહેનોને અતિ ઉત્સાહથી નવી મેમ્બરશીપનું રજિસ્ટ્રેશન કરાવવા લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા અને વાઘબકરી ચાની ગરમ ચુસ્કી સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો.

મંડળના સેક્રેટરી શ્રીમતી કવિતાબેને નવા મેમ્બર મંડળના નિયમોથી અવગત કરાવતા સૌને આવતા ત્રણ વર્ષ સાથે માટે સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના અતિથિવિશેષ શ્રીમતી નિપાબેન નીતિનભાઈ

વોરાનો પરિચય કરાવતા પ્રમુખ શ્રીમતી તુલાબેન તથા ઉપપ્રમુખ શ્રીમતી દિપ્તિબેને તેમનું પુષ્પગુચ્છ આપી બહુમાન કર્યું હતું. શ્રીમતી નિપાબેન વોરાએ બે શબ્દો બોલી મંડળને સંબોધન કર્યું હતું અને મંડળના સુંદર સંચાલન તથા એકતા બદલ કમિટીનું અભિવાદન કર્યું હતું તથા આગળ પણ મંડળથી જોડાઈને સાથ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

શ્રી વિકાસભાઈએ કાર્યક્રમનો દોર સંભાળતાં બહેનોએ મનોરંજન પીરસવાનું શરૂ કર્યું હતું, જેમાં બહેનોએ રસપૂર્વક ભાગ લીધો અને હસતાં હસતાં આ મનોરંજન ઝીલ્યું હતું.

થોડા સમય બાદ નવા પદને સંભાળતાં સેક્રેટરી શ્રીમતી ફાલ્ગુનીબેન મહેતાએ માર્ગિક સંભાળતા ત્રણ વર્ષ માટે નવા બનેલા આઈ કાર્ડની વિગત સમજાવી હતી. નવા આઈ કાર્ડ બનાવવામાં મુખ્ય ફાળો આપી જવાબદારી સંભાળવા બદલ પ્રમુખ તુલાબેને ફાલ્ગુનીબેનને વધાઈ આપી હતી.

આઈ કાર્ડના દરેક સ્પોન્સરની એક પછી એક ઓળખાણ આપતા મંડળના દરેક મેમ્બર તથા જેમણે પોતાની જાહેરખબર આપી આઈ કાર્ડને સુંદર બનાવવામાં યોગદાન આપ્યું તેઓનો ધન્યવાદ વ્યક્ત કરાયો હતો. જાહેરખબર આપનાર દરેકની સર્વિસનો લાભ લઈ મંડળ

દ્વિતીય પુણ્યતિથિએ હાર્દિક શ્રદ્ધાંજલિ

જન્મ :

તા. ૨૯-૫-૧૯૨૭



અરિહંતશરણ :

તા. ૨૯-૩-૨૦૧૮



સ્વ. શ્રી નરોત્તમભાઈ મંગળજી દોશી

સુગંધ આપના સ્નેહની પ્રસરતી રહેશે,

વસ્યા છો દૂર છતાં, કૃપા આપની વરસતી રહેશે.

હતા નજર સમક્ષ, પાંપણ પલકારે મોક્ષ પામી ગયા,

દર્શન નથી તમારા દેહના પણ હૃદયમાં તમારો વાસ છે.

લિ. : શ્રીમતી પુષ્પાબેન નરોત્તમભાઈ દોશી પરિવાર

પુત્ર : પરેશ

પુત્રવધૂ : દીના

પૌત્ર : ઉમંગ

પૌત્રી : પ્રાચી

દીકરી-જમાઈ : નીતા કિશોર ગાંધી

નિધી જીતેશ ગાંધી

જૈનમ જીતેશ ગાંધી

દીકરી-જમાઈ : દક્ષા રાજેશ શાહ

રિદ્ધિ - ધૈર્ય

માટે ખાસ ઓફર કરાયેલી સ્કીમનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ વિકાસભાઈએ ફરી દોર હાથમાં લેતાં ગેમ રમાડવાનું ચાલુ કર્યું હતું, જેમાં ભાગ લઈને દરેક મેમ્બર બહેનોએ જીતવાનો આનંદ, રમવાનો ઉમળકો તથા સંગીતની સાથે સાથે ગરબાની રમઝટ બોલાવી દરેકની મજામાં ઉમેરો કર્યો હતો. જીતનાર બહેનોએ પ્રાઈઝ આપીને તથા નાટકની ટિકિટ આપી ઉત્સાહ વધારાયો હતો, જેની ખુશી બહેનોનાં ચહેરા પર સાફ વર્તાતી હતી.

સભ્ય બહેનોએ મંડળના સારા-નરસા પ્રસંગોમાં ભેટ લખાવી હતી, જેનો સ્ટેજ પરથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમની પણ તે દિવસે બર્થડે હતી તેમને સ્ટેજ પર બોલાવી દરેક બહેનોએ જન્મદિવસની વધાઈ આપી શુભેચ્છા પાઠવી હતી.

ત્યારબાદ આટલા વર્ષોના સુંદર નેતૃત્વ કરી સફળ સંચાલન કરનાર પ્રમુખ શ્રીમતી તુલાબેન મહેતાનું કમિટીની બહેનોએ ભાવભરે પુષ્પગુચ્છ અર્પણ કરી બહુમાન કરી

પોતાનો ભાવ દર્શાવ્યો હતો.

ત્યારબાદ કમિટીની બહેનોની નવા કાર્યભાર સાથે થયેલી વરણીની જાહેરાત કરવામાં આવી, જેને મંડળની બહેનોએ તાળીઓનાં ગડગડાટ સાથે વધાવી લીધું હતું.

મંડળના ખજાનચી શ્રીમતી પ્રીતિબેન ચેતનભાઈ વસાએ વોટ ઓફ થેક્સની જવાબદારી લઈ વિકાસભાઈનો આભાર માન્યો તથા કેટરીંગ સર્વિસ આપી સૌને ટેસ્ટી ભોજન પીરસી દીલ ખુશ કરનાર શ્રીમતી દિપાલીબેન ડિમ્પલભાઈ મહેતા (જેઓ પોતે મંડળના સભ્ય પણ છે) તથા વાઘબકરી ચાના સ્પોન્સરરનો આભાર વ્યક્ત કર્યો હતો.

અંતમાં પ્રીતિભોજનને માન આપી બહેનોએ માણેલા આનંદને બમણો કર્યો હતો. આમ પૂરી કમિટીના સાથ સહકારથી આ કાર્યક્રમનું સુંદર આયોજન પાર પડ્યું હતું.

પ્રમુખ :

શ્રીમતી તુલાબેન મહેતા

સેક્રેટરી :

શ્રીમતી ફાલ્ગુનીબેન મહેતા

આનંદની અનુભૂતિ એટલે વિચારોમાં સકારાત્મકતા

માતા સાથે રહેતી દિવ્યા એક સાધારણ સ્ત્રી હતી. મોટી કંપનીમાં સેક્રેટરી તરીકે નોકરી કરતી હતી, પણ જીવન એકધારું કંટાળાજનક બની ગયેલું. ઑફિસમાં પણ તેના તરફ કોઈ ખાસ ધ્યાન ન આપતું.

એક દિવસ સવારે ઑફિસે જતાં રસ્તામાં એક દુકાન-હૉટની-ખૂલેલી જોઈ. અંદર ગઈ તો ઘણા લોકો જુદીજુદી હૉટ પહેરીને અરીસામાં જોતા હતા. દિવ્યાએ પણ એક હૉટ પહેરી જોઈ. તેને બહુ ગમી ગઈ. એક નાની છોકરીએ તેને જોઈને પોતાની માતાને કહ્યું કે, મમ્મી જો ને, એ સ્ત્રી હૉટ પહેરીને કેવી સુંદર દેખાય છે.

દિવ્યાએ અરીસામાં જોયું. તેને પોતાનું શરીર ખૂબ જ ગમ્યું. તે હસતે મોઢે કાઉન્ટર પર ગઈ અને હૉટ બરીદી લીધી.

જેવી તે બહાર આવી તો જાણે નવા વિશ્વમાં આવી ગઈ હોય તેવું લાગ્યું.

ઑફિસમાં આવી તો ચોકીદારે તેને હસીને ગુડ મોર્નિંગ કહીને લિફ્ટનો દરવાજો ખોલ્યો.

લિફ્ટમાં અંદર હતા તે લોકો પણ 'તમારે માટે કયા માળનું બટન દબાવું તેમ પૂછવા લાગ્યા.'

ઑફિસના માણસો પણ 'આજે કાંઈક જુદી દેખાય છે' તેવું કહેવા લાગ્યા. તેણે ટેક્સી માટે હાથ લંબાવ્યો તો એકના બદલે

બે ટેક્સી ઊભી રહી ગઈ.

દિવ્યા આજના ચમત્કારિક દિવસ વિષે વિચારવા લાગી. આ બધું પેલી હૉટને કારણે જ થયું છે.

ઘરે આવી. માતાએ બારણું ખોલ્યું અને કહ્યું, 'દિવ્યા, તું કેટલી સરસ દેખાય છે. તારી આંખો! નાની છોકરી જેવી ચમકતી દેખાય છે.'

'હા માં, દિવ્યાએ કહ્યું, 'આ બધું નવી હૉટને કારણે છે. મારો આજનો દિવસ અદ્ભુત રહ્યો.'

'કઈ હૉટ?' માંએ પૂછ્યું.

દિવ્યા ગભરાઈ ગઈ. માથે હાથ મૂક્યો તો હૉટ તો નહોતી. યાદ કર્યું, હૉટ તો ક્યાંય ઉતારી નથી. તેને યાદ આવ્યું કે, કાઉન્ટર પર પૈસા ચૂકવતી વખતે ઉતારેલી હૉટ ત્યાં જ ભૂલી ગઈ હતી.

ત્યાંથી બહાર આવી ત્યારે હૉટ વગર, પણ પ્રફુલ્લિત અને ઉત્સાહથી છલકાતી.

આપણા વિચારો જ આપણને બાંધી રાખીને ગુલામ બનાવે અથવા આઝાદ પંખી જેવા મુક્ત બનાવે છે અને તે પ્રમાણે આપણને બહારનું વિશ્વ દેખાય છે.

એ જ જાદુઈ શક્તિ છે સમર્થ સકારાત્મક વિચારોમાં.

- પદ્મા બગડિયા લાખાણી

આભાર-કથાસ્ત્રોત ભરત કા. હર્ષદ દવે, જન્મભૂમિ

શ્રદ્ધાંજલિના શ્રદ્ધાસુમન

જન્મ :

તા. ૫-૨-૧૯૪૭



અરિહંતશરણ :

તા. ૭-૩-૨૦૧૫



સ્વ. હર્ષદભાઈ રતિલાલ મહેતા

તમે આવ્યા અમારા જીવનમાં, ફૂલછડી બનીને,
ધૂપસળી બની સર્વત્ર મહેંકી ઊઠ્યા,
યાદ તમારી આવતા આંખલડી છલકાય છે,
જોઈ તસવીર તમારી, આંસુ ઊભરાય છે.

પ્રેમાળ પરિવાર

સ્વ. વિમળાબહેન રતિલાલ મહેતા

શ્રીમતી કિરણબહેન હર્ષદભાઈ મહેતા

ચિ. બિનીતા નિખિલેશ ઉત્પત્ત

રમેશભાઈ - હેમલતાબેન

મધુકરભાઈ - પ્રજ્ઞાબહેન

મનોજભાઈ - કુંદનબહેન

ઈન્દુબહેન - સ્વ. ભૂપતરાય અજમેરા

સરલાબહેન - સ્વ. નીતિનભાઈ વોરા

મીનાક્ષીબહેન - નરેશભાઈ વોરા

સ્વ. નિર્મળાબહેન કાંતિલાલ વોરા

મહેશભાઈ - પ્રીતિબહેન

પંકજભાઈ - રેખાબહેન

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન ઉત્કર્ષ મંડળ, મુલુન્ડનો

તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના યોજાયેલ સ્નેહમિલન પ્રોગ્રામનો અહેવાલ



શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન ઉત્કર્ષ મંડળ, મુલુન્ડનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રવિવારનાં માંડવી હોલ રિસોર્ટમાં યોજવામાં આવેલ હતો. મંડળનાં ૩૫૪ મેમ્બર તથા ૧૦ આમંત્રિત મહેમાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

મુલુન્ડથી ૫ તથા ડોંબિવલીથી ૨ એમ કુલ ૭ બસ હતી. સવારમાં પહેલા બધાએ મહાવીરધામ (સીરસાડ)માં દર્શન-વંદન કર્યા હતા. ત્યાર બાદ બધાને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.

મંડળની આ પિકનિક બધા મેમ્બર માટે ફ્રી રાખવામાં આવી હતી. બધા પાસેથી રીફંડેબલ ટોકન રૂ. ૨૦૦ લેવામાં આવ્યા હતા.

૯ વાગે રિસોર્ટમાં ગરમાગરમ ચા-પાણી નાસ્તો રાખવામાં આવેલ. ત્યારબાદ બધા સભ્યોએ મન મુકીને રિસોર્ટમાં વિવિધ રાઈડસ અને સ્વિમિંગનો આનંદ લીધો હતો. ૧૧.૩૦થી બધાએ ગરમાગરમ સુપ-તથા ઢોસા-પોપકોર્ન -ગોલા-કેન્ડીકલોઝની મન મુકીને મજા લીધી હતી.

બપોરે ૧.૩૦થી ૨.૩૦ વાગ્યા સુધી ભોજનને ન્યાય આપી લગભગ ૩ વાગે સીંગર નયનાબેન આચાર્ય તથા તેમના સાથી કલાકારો દ્વારા સુમધુર ગીત-સંગીત-મિમિકીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત નવકાર મહામંત્રથી કરવામાં આવી હતી. ૫ વાગે મંડળનો સ્ટેજ પ્રોગ્રામ તથા શરૂઆતમાં પધારેલ આમંત્રિત મહેમાનોનું સ્વાગત શ્રી પરેશભાઈ મણિલાલ શેઠ દ્વારા પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન મંડળ, ઘાટકોપરની પરિમલભાઈ ભીમાણી તથા શ્રી ધીરેનભાઈ વસા શ્રી. સોરઠ વિશાશ્રીમાળી જૈન મહિલા મંડળ ઘાટકોપરના શ્રીમતી દર્શનાબેન ભીમાણી તથા શ્રીમતી હેતલબેન મહેતા, શ્રી. સોરઠ વિશાશ્રીમાળી મંડળ, બોરીવલીથી શ્રી સંજયભાઈ ડી. મહેતા તથા શ્રી નીકુંજ વી. સેઠ, શ્રી એસ. વી. જૈન જાગૃતિ મંડળ નાલાસોપારાથી શ્રી બીપીનભાઈ રામાણી તથા શ્રી અભયભાઈ પારેખ, શ્રી એસ. બી. મહિલા મંડળ, નાલાસોપારાથી શ્રીમતી કરીશમાબેન પારેખ તથા શ્રીમતી માયાબેન વસા વગેરે અમારા આમંત્રણને માન આપી પધારેલ હતા.



અહાઈ તથા તેનાથી વધારે તપસ્યા કરનાર તપસ્વીનું બહુમાન આપણને ૨૫ વર્ષથી સંવત્સરીક પ્રતિક્રમણ કરાવનાર જયસુખભાઈ દોશી તથા સલાહકાર સમિતિનાં સભ્યો શ્રી હસમુખભાઈ પુનાતર તથા શ્રી પરાગભાઈ દોશીનાં વરદહસ્તે કરવામાં આવેલ હતું.

મંડળનાં પ્રમુખ શ્રી ગુણવતંભાઈ મહેતાએ મંડળની ત્રિવાર્ષિક યોજનામાં સહભાગી થવા બધા સભ્યોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મંડળની ઓફિસ બાબત તથા ભાવિ યોજના બાબત બધાને માહિતગાર કર્યા હતા. ત્રિવાર્ષિક યોજનામાં ઘર દીઠ રૂ. ૩૦૦૦/- કે તેથી વધુનું અનુદાન ત્રણ વર્ષ માટે લેવાનું નક્કી કરેલ હતું. શ્રી ગુણવતંભાઈ મહેતાએ મંડળની પ્રવૃત્તિમાં તન-મન-ધનથી સાથ આપવા બદલ મંડળનાં દરેક સભ્યોનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આજ રીતે સાથ-સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વાર્ષિક પરીક્ષામાં પ્રથમ તથા દ્વિતીય સ્થાન મેળવનાર બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન ઉપપ્રમુખશ્રી

રાજેશભાઈ શાહ, માનદ મંત્રી શ્રી રોહિતભાઈ શેઠ, ખજાનચી શ્રી નિમેશભાઈ વોરા તથા ભાવનાબેન કોરડિયા દ્વારા કરવામાં આવેલ.

મંડળની યોજનામાં રૂ. ૫૦૦૦થી વધારે અનુદાન આપનાર દાતાઓનું બહુમાન કારોબારી સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી રાજેશભાઈ પુનાતર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

ત્યારબાદ સાંજે ફરીવાર નયનાબેન તથા સાથી કલાકારો દ્વારા ગીત-ગરબાના કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો. દરેક નાની-મોટી વ્યક્તિએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

સાંજે ૭ વાગે મનભાવન ભોજન કરી પોતપોતાની બસમાં ઘર તરફ પ્રયાણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંમેલન માનદ મંત્રી શ્રી રાજેન્દ્ર પુનાતર દ્વારા કરવામાં આવેલ હતું.

લિ. : શ્રી રાજેન્દ્ર ઓ. પુનાતર - માનદ મંત્રી
શ્રી રોહિત એમ. શેઠ - માનદ મંત્રી

MATRIMONIAL

Name : Hardik Viresh Mehta
Date of Birth : 6th May 1995
Birth Time : 9.10 pm
Birth Place : Nallasopara (Dist. Palghar)
Height : 5'10"
Caste : Shri Sorath Visha Shrimali
Deravasi Jain
Native Place : Majevasi (Junagadh)
Hobby : Playing, Cricket and Football
Listening to Music
Education : Post Graduation Diploma in
Financial Management
B.COM. and BCA
Professional Details : Working at KPMG as IT Audit Analyst
Mobile Number : **8767976377**
Email ID : hardikmehta060595@gmail.com
Residential Address : 202, Jeevan Mandir CHS Ltd, Shimpoli Road,
Opposite Gokhale High School,
Above Waman Hari Pethe Jewellers,
Borivali (West), Mumbai - 400 092.

**FAMILY DETAILS**

Father : Viresh Vinaychand Mehta
Contact Details : **9892466654**
Mother : Jayshree Viresh Mehta
Contact Details : **9323075617**

PATERNAL DETAILS


Grand Father : Late Shri Vinaychand Vitthalji Mehta
Grand Mother : Late Shreemati Gunvanti Vinaychand Mehta

MATERNAL FAMILY

Grandfather : Late Shri Chimanlal Valjibhai Vasa
Grandmother : Late Shreemati Manjulaben Chimanlal Vasa
Uncle : Mayur Chimanlal Vasa
Uncle : Pradeep Chimanlal Vasa



શ્રદ્ધાંજલિ



સ્વ. શ્રી વૃજલાલ જગજીવનદાસ વોરા

મૂળ વતન : ધોરાજી

જન્મ તારીખ: ૨૮-૧-૧૯૩૧ સ્વર્ગવાસ : તા. ૮-૩-૨૦૦૫

તમે ધૂપસળી જેવું જીવન જીવી ગયા,

સુગંધ જેની ચોતરફ મૂકતા ગયા.

સુખને છલકાવ્યું નહીં, દુઃખને દેખાડ્યું નહીં

જીવન તમે એવું જીવ્યા, ભૂલ્યું ભૂલાય નહીં.

સુગંધ આપના સ્નેહની પ્રસરતી રહેશે

વસ્યા છો દૂર છતાં, કૃપા આપની વરસતી રહેશે.

આપનો હસતો તેજસ્વી ચહેરો, પરોપકારી સ્વભાવ,

ધર્મ અને જીવન પ્રત્યેની ઉદાર ભાવના.

સમાજ અને કુટુંબ પ્રત્યેની શુભ ભાવના સદાયે યાદ રહેશે.

લિ.

ગં. સ્વ. વિજયાબેન વૃજલાલ વોરા

કિરીટ, ગીતા, કેવીન, ખ્યાતિ, યુગ, વિહાન, શૈલેષ, રૂપલ, કેવલ,

કૈલેશ, નીતા, હેનલ, પ્રિયા, રાજેશ, બીના, આગમ

જ્યોતિ રાજેન્દ્રભાઈ મહેતા

-: શ્રી જગજીવનદાસ સીરાજ વોરા પરિવાર:-

VORA SHAILESH VRAJLAL

D-401, PANCHAM APT., BLDG., NO. 1, HEMU KALANI ROAD NO. 2.,

IRANI WADI, KANDIVALI (W), MUMBAI - 400 067.

MOBILE - 9821045422

આજના સમયમાં... અહિંસક જીવનશૈલી

અહિંસા શબ્દનો અર્થ ખુબ સરળ છે. દરેક મનુષ્ય એમ વિચારે કે દુનિયામાં મારા સિવાય બીજા મનુષ્યો અને બીજા જીવો છે. એ દરેકને પણ જીવન વ્હાલું છે. તેમને પણ દુઃખ ગમતું નથી' આપણે આ વિચાર મનમાં રાખીને આપણું દરેક કાર્ય કરીએ તો દરેકનું જીવન નંદનવન બની જાય.

આજના સમયમાં ગૃહસ્થ અથવા સાધુ માટે પણ ૧૦૦ ટકા અહિંસક જીવન જીવવું ખુબ જ મુશ્કેલ છે. હાલતાં-ચાલતાં-ઊઠતાં-બેસતાં-ખાતાં પીતાં બીજા કોઈ જીવને હાની થવાની શક્યતા છે પરંતુ આપણે બને તેટલું સાચવીને-સમજીને 'ઓછામાં ઓછી' હિંસા થાય તેવી કોશિશ કરીએ તો પણ આ પૃથ્વી ઉપરના ઘણાં બધાંનાં ઘણાં બધાં દુઃખ દર્દ દૂર થઈ જાય.

બીજો એક અગત્યનો સિદ્ધાંત છે 'સહઅસ્તિત્વ'. કોઈપણ જીવને દુખી કરીને સુખ મળે નહીં. સ્વામી આનંદના કહેવા પ્રમાણે 'આપણને શાશ્વત સુખ મળતું નથી કારણ કે આપણું સુખ બીજા પાસેથી છીનવેલું સુખ છે.' કોઈ વિદ્વાને તો ત્યાં સુધી કહ્યું છે કે 'આફ્રિકાના જંગલમાં ભૂખથી કૂતરાનું મૃત્યુ થાય તો તેનો દોષ પણ આપણને લાગે છે.' બીજું સત્ય એ પણ છે કે આપણી આજુબાજુમાં કોઈ પણ જીવ દુઃખી હશે તો તેના દુઃખનો રેલો ક્યારેક તો આપણા ઘર સુધી આવશે જ. આ દુખનો ભય અતિશ્રીમંત કે ખુબ શક્તિશાળી માણસને પણ ત્યાં સુધી રહેવાનો છે જ્યાં સુધી દરેક જીવ કાયમી સુખ ન પામે.

સદીઓથી વિશ્વમાં હજારો સંસ્થાઓ અને દાતાઓ સામાજિક કાર્યો કરે છે તેમ છતાં પણ લોકોના દુઃખ દર્દ વધી રહ્યા છે. પ્રાણીઓના જીવન તો નર્ક બની ગયા છે. આનો અર્થ એમ કરી શકાય કે ક્યાંક તો પાયામાંથી ખોટું થઈ રહ્યું છે જે સુધારવાની જરૂર છે.

સદીઓથી ચાલી આવતી ખાવા-પીવા-જીવન જીવવાની પ્રથામાં કોઈ ફેરફાર જરૂરી હોય તો કરીએ. તે પૌરાણિક કાળથી ચાલે છે તેટલે 'સંસ્કૃતિ' જ કહેવાય

તેવું નથી. તેમાં પણ સમયકાળે કોઈ 'વિકૃતિ' પેસી જાય તો પ્રથામાં ફેરફાર જરૂરી છે.

આજના સમયમાં આપણે કેવી રીતે અહિંસક જીવનશૈલી અપનાવી શકીએ તેની ચર્ચાને આપણે જુદા જુદા વિભાગમાં વહેંચી શકીએ - (૧) પ્રાણીઓ પ્રત્યે જીવદયા (૨) મનોરંજન માટે પ્રાણીઓનો ઉપયોગ (૩) રાજકારણ અને પશુરક્ષાના કાયદા (૪) આપણું સ્વાસ્થ્ય (૫) પર્યાવરણ (૬) કતલખાનાઓ બંધ કરી રીતે થાય (૭) ધર્મ (૮) નાગરિક તરીકેની ફરજ-વ્યાપાર અને વ્યવહાર (૯) કેવી હશે અહિંસા - સ્વપ્નનગરી?

(૧) પ્રાણીઓ પ્રત્યે જીવદયા -

આપણામાંથી મોટા ભાગના લોકો અને ખાસ કરીને જૈન લોકોમાં જીવદયા એટલે પાંજરાપોળને મદદ કરવી, કતલખાને જતાં જીવને છોડાવવા કે પછી કબુતરને ચણ નાખવી. આપણે આપણી જીવન જીવવાની રીતમાં શું ફેરફાર કરવો તે આપણે વિચારતા નથી. આપણા પોતાના લીધે કોઈ જીવને હાની થાય છે કે તે કતલખાને જાય છે તેમાં અજાણતા આપણો હાથ છે કે કેમ તે વિચારવાની જરૂર છે.

આપણા દરેકના ઘરમાં એક 'મીની કતલખાનું' ચાલતું હોય છે. ખાવા પીવા, ઘર વપરાશ, કોસ્મેટીક, પગરખાં, કપડાં, વગેરે દરેક વસ્તુમાં પ્રાણીઓનાં અવયવોનો ઉપયોગ થાય છે. આ દરેક વસ્તુઓનાં 'અહિંસક' ઉપાયો પણ છે. કતલખાનાઓને માંસની આવકની જેમ પ્રાણીઓના બીજા અવયવો જેમકે ચરબી, વાળ, ચામડું, હાડકાં વગેરેમાંથી પણ ઘણી બધી આવક મળે છે. કતલખાનાઓને આ બીજી આવક ઓછી થાય તો બહુ મોટું આર્થિક નુકશાન થાય.

ચામડું એટલે પ્રાણીઓની 'ચામડી' છે. ભારત દેશમાં ચામડાનો ઉદ્યોગ બહુ મોટા પાયે વિકસી રહ્યો છે. પહેલાના સમયમાં પ્રાણીઓ કુદરતી રીતે મૃત્યુ પામતા તેની ચામડી ઉપયોગમાં લેવાતી હતી. આજે જીવતા પ્રાણીની કતલ થાય છે અને તેની ચામડી ઉતારી લેવાય

છે. થોડા સમય પહેલા સમાચાર હતા કે લેધર કાઉન્સિલ (ચર્મ ઉદ્યોગનું વ્યાપારી મંડળ) ચામડાની માંગને પહોંચી વળવા માટે પ્રાણીઓને બિનક્રુદરતી રીતે જન્મ અપાવશે, તેને ઉછેરશે અને કતલ કરીને તેની ચામડી ઉપયોગમાં લેશે. આવી ભયંકર યોજના વ્યાપારી લોભની ચરમસીમા છે.

પહેલાનાં સમયમાં દુધ-ધીનો ઉપયોગ કદાચ બરાબર કહી શકાય પરંતુ આજના વ્યાપારીકરણના સમયમાં પ્રાણીઓને મશીન સમજીને દુધ મેળવવામાં આવે છે. ‘પશુપાલન’માંથી ‘પશુઉદ્યોગ’ થઈ ગયો છે. ગાય ભેંસના વાછરડાને તેની માતાનું દૂધ પીવા દેવામાં આવતું નથી. વાછરડું જો નર હોય તો આજના ટ્રેકટર યુગમાં તેની જરૂર નથી તેથી તે તરત જ કતલખાને જાય છે. બિન ક્રુદરતી પદ્ધતિથી ગાય-ભેંશને માતા બનાવાય છે કારણ કે આપણને દુધ જોઈએ છે. ૧૯૭૦ની શ્વેત ક્રાંતિ પછી માંસની નિકાસ ચાલુ થઈ. આજે ભારત વિશ્વમાં માંસની નિકાસમાં એક નંબર પર છે. તે દૂધની વધતી જતી જરૂરિયાતને લીધે છે.

ભારત દેશમાં ગાય માતા તરીકે પૂજાય છે. પરંતુ સાંકળ/દોરડાથી બંધાય છે. તેની લે-વેચ થાય. તેનું મૂલ્ય અંકાય. રસ્તા પર પ્લાસ્ટિક કે કચરો ખાય. આ તે કેવી સંસ્કૃતિ કહેવાય?

આજે આખું વિશ્વ ‘વિગન’ પદ્ધતિ તરફ ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિગન લોકો પ્રાણીઓની કોઈ વસ્તુઓનો ઉપયોગ કરતા નથી. તેઓની કરુણાનો પ્રવાહ કોઈ ધર્મ માટે નહીં પણ પ્રાણીઓ પ્રત્યે માનવતાની ફરજ તરીકે વહી રહ્યો છે. દુનિયાના મોટા મોટા રમતવીરો ‘વિગન’ છે. ભારતમાં પણ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બીજા ઘણા વિગન છે. દૂધ-ધી ખાવાથી તાકાત આવે છે તે ખોટું પુરવાર થઈ ચુક્યું છે.

વિગન લોકો ગોમૂત્ર કે છાણને પણ કોઈ વપરાશમાં લેતા નથી. ધંધાદારી લોકોનું કાંઈ કહેવાય નહીં. તેઓ દુધની જેમ ગોમૂત્ર કે છાણ વધારે મેળવવા માટે પ્રાણીઓ પર અત્યાચાર કરવાનું ચાલુ કરે. પ્રાણીઓને સ્વતંત્ર રહેવા દઈએ તે જ સારું છે. વિગન જીવન પદ્ધતિમાં

મધનો ઉપયોગ પણ નિષેધ છે.

હવે આપણને સોયા, મગફળી, નાળિયેરી, કાજુ, બદામ, ચોખા વગેરેના દૂધમાંથી બનેલ દહીં-ધી-મીઠાઈઓ-ચીઝ-બટર-આઈસ્ક્રીમ વગેરે પણ મળે છે. આ માટે ગુગલ અને યુટ્યુબ પર હજારો રેસીપી છે.

(૨) મનોરંજન માટે પ્રાણીઓનો ઉપયોગ -

સર્કસ, માછલીઘર, પ્રાણી સંગ્રહાલયો, પક્ષીઓને પિંજરામાં પૂરવા, બળદ અને ઘોડાની રેસ વગેરે પ્રવૃત્તિઓમાં બીજા જીવોની સ્વતંત્રતા છીનવી લેવાય છે. તેમને હાની પહોંચાડાય છે. આપણે તેનાથી દૂર રહીએ. આપણને પાંજરામાં પૂરીને જંગલમાં આ પાંજરાઓ રાખીને પ્રાણીઓને બતાવવામાં આવે કે જુઓ મનુષ્યો આવા લાગે છે. આમ થાય તો આપણને કેવું લાગે?

(૩) રાજકારણ / પ્રાણી રક્ષાના કાયદા -

આજે દેશના મોટાભાગના રાજ્યોમાં ગાયની કતલ પર પ્રતિબંધ છે પરંતુ ભેંશની કતલ કરી શકાય છે. ગાય ને માતા કહેવી પરંતુ ભેંશ પણ માતા છે તે સ્વીકારવું નથી. કોઈ કહેવાતી ધાર્મિક માન્યતાને સાચવી લેવી અને તેની પાછળ મોટા પાયે જીવહિંસા થવા દેવી આ રાજકારણનો એક પ્રપંચ છે.

પશુ રક્ષાના કાયદામાં ‘પશુઓની કતલ માનવીય રીતે કરવી જોઈએ. તેમને મરતી વખતે પીડા ન થાય તેવું કરવું જોઈએ.’ તેવું લખાણ છે. કતલ માનવીય રીતે કેમ થાય? કતલ કરવી તે જ માનવીય નથી. સરકારનો પશુપાલન વિભાગ કતલખાના માટે સબસીડી આપે છે. પરંતુ કાયદો આંધળો છે. જે કરવું પડશે તે આપણે જ કરવું પડશે.

(૪) આપણું સ્વાસ્થ્ય -

બહુ બધા સંશોધનોમાં એ સાબિત થયું છે કે પ્રાણીજન્ય વસ્તુઓ (દુધ-ધી, વિ.)ના લીધે કેન્સર-ડાયાબીટીસ-હૃદયરોગ જેવા ગંભીર રોગો થાય છે. આજના સમયમાં વિશ્વમાં બનતી ૮૦ એન્ટીબાયોટીક દવાઓ પશુઓને આપવામાં આવે છે. આ દવાઓ અને પશુઓની પીડામાંથી મેળવેલ દૂધ આપણને સ્વાસ્થ્ય

અને શાંતિ કઈ રીતે આપી શકે ?

મનુષ્યની જેમ પ્રાણીઓ પણ માતા બને ત્યારે જ દૂધ આપે છે અને તે તેના બાળક માટે છે. તેના વાછરડાના ભાગનું છીનવી લીધેલ દુધથી આપણને કઈ રીતે સુખ અને શક્તિ મળે ?

આપણે છાપાઓમાં વારે તહેવારે સમાચાર વાંચતા હોઈએ છીએ કે ‘ભેળસેળવાળું દુધ’ પકડાયું. હમણાં તો ભેળસેળવાળું પનીર અને બટર પણ પકડાયું તેવા સમાચાર હતા. કોઈપણ વસ્તુઓની માંગ વધશે એટલે તેમાં આવું બનવાનું જ છે. દુધની ભેળસેળમાં કલર, યુરીયા ખાતર, ડીટરજન્ટ પાવડર, વિ. વસ્તુઓનો ઉપયોગ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે.

(૫) પર્યાવરણ

આજના સમયનો સુધરેલ અને ભણેલ માણસ હવે ‘પશુઓ દ્વારા થતી ખેતી’ને બદલે ‘પશુઓની ખેતી’ (animal farming) કરે છે. કરોડોની સંખ્યામાં પ્રાણીઓને બિનકુદરતી રીતે જન્મ અપાવવો, તેનો ઉછેર કરવો અને માંસ માટે તેને મારવા તે પર્યાવરણનો બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. વિશ્વમાં વાહન વ્યવહારમાંથી જે પ્રદુષણ થાય છે તેના કરતા પ્રાણીઓ દ્વારા થતું પ્રદુષણનું પ્રમાણ વધારે છે. વિશ્વના વિકસિત દેશો માંસાહાર ઓછો થાય તે માટે કોશિશ કરી રહ્યા છે.

બહુ બધા લોકો ‘સ્વાસ્થ્ય અને પર્યાવરણ’ના કારણે પણ ‘વિગન’ પદ્ધતિ અપનાવી રહ્યા છે.

(૬) કતલખાનાઓ બંધ કઈ રીતે થાય ?

કતલખાનાઓ બંધ કરવા હોય તો સૌથી સહેલો ઉપાય છે આપણી દૂધ અને દૂધની વસ્તુઓની માંગ ઘટાડવાનો. અર્થશાસ્ત્રના મૂળભૂત નિયમ મુજબ દુધની માંગ ઓછી થાય તો તેના ભાવ ઘટે અને વ્યાપારી કંપનીઓને આ વ્યવસાયમાં ઓછો રસ પડે. ડેરી ઉદ્યોગને આ વ્યવસાયમાં આર્થિક લાભ નહીં દેખાય. આવું કરવાથી ‘પશુઉદ્યોગ’ પાછો ધીરે ધીરે ‘પશુપાલન’માં પરિવર્તિત થશે. દૂધ માટે પ્રાણીઓ પર

થતાં અત્યાચાર ઓછા થાય. પશુઓનો બિનકુદરતી રીતે જન્મ નહીં કરાવવામાં આવે. પ્રાણીઓની સંખ્યા ઓછી થશે. કતલખાનાઓને ડેરી ઉદ્યોગ પાસેથી ‘તેમના માટે બિન ઉપયોગી થયેલા’ પ્રાણીઓ ઓછા મળશે. માંસનું ઉત્પાદન ઘટે. માંસના ભાવ વધે. ઓછા લોકો માંસાહાર કરે. આ બધાને લીધે જીવહત્યા ઓછી થાય.

૧૯૭૦ના વર્ષની શ્વેત ક્રાંતિ (દૂધની ક્રાંતિ) પછી ભારતમાં દૂધ ધીની સાથે સાથે પશુઓના લોહીની નદીઓ વહેવા લાગી છે. માંસ-ચામડું-દુધ આ ત્રણ વસ્તુઓના વ્યાપારમાં એકસરખો વધારો થઈ રહ્યો છે. આ જુગલબંધી છે. આપણે આમાંથી દૂધ અને ચામડાની માંગ ઘટાડીએ તો ફક્ત માંસના જોર પર કતલખાના આર્થિક રીતે ટકી ના શકે.

વિગન જીવનપદ્ધતિ પણ ‘અહિંસા ધર્મ’નો એક અંશ છે. અહિંસા એટલે તે ફક્ત ખાવા પીવા કે વસ્તુઓ આધારિત નથી પરંતુ આપણા જીવનની નાની મોટી દરેક બાબતોનો સમાવેશ કરે છે.

(૭) ધર્મ

છેલ્લાં ૨૫૦૦ વર્ષમાં ભગવાન મહાવીરે ‘અહિંસા પરમો ધર્મ’ કહ્યા પછી ગાંધીજીએ અહિંસાના સૂત્રને વિશ્વના ખૂણેખૂણે સુધી પહોંચાડ્યું અને તે પણ કોઈ સાંપ્રદાયિક ધર્મના નેજા નીચે નહીં પણ માનવતાના પાયાના સિદ્ધાંત તરીકે કર્યું. કદાચ એવું લાગે છે કે ‘અહિંસા-જીવહત્યા’ શબ્દને હિંદુ-જૈન ધર્મ સાથે જોડીને આપણે પ્રાણીઓનું અહિંસા કર્યું છે. જાણે અજાણે બીજા ધર્મના લોકો આનાથી દૂર થઈ ગયા. આપણને જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો લોકો સુધી પહોંચે તેમાં રસ હોવો જોઈએ. તેઓ કોઈ પણ ધર્મ પાળે તેનાથી શું ફરક પડે ?

ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે ભગવાને પણ દુધ વાપર્યું છે. પરંતુ, ત્યારના સમયકાળમાં આજની જેમ દુધની માંગનો અતિરેક ન હતો. ભગવાને પણ કહ્યું છે કે તમે સમયકાળ પ્રમાણે તમારો અંતરાત્મા કહે તે પ્રમાણે વર્તજો.

આજે ધર્મસ્થાનોમાં પણ ઘણી હિંસા થઈ રહી છે.

દેરાસરોમાં વરખનો ઉપયોગ તે ઘણી ખરાબ બાબત છે. વરખ બનાવવા માટે પ્રાણીઓનો જીવ લેવાય છે. સિલ્ક બનાવવા માટે હજારો રેશમના કીડાને ઊકળતા પાણીમાં ઊકાળવામાં આવે છે. પ્રભુજીને ફૂલો ચડાવવાની પ્રથામાં પણ હિંસા છે. આપણા જૈન ધર્મના વિદ્વાન શ્રી કુમારપાળ દેસાઈએ એવું કહેલ છે કે ‘દેરાસરોમાં મહાપૂજા થાય છે તે ફૂલોની શોકસભા છે.’ પ્રાણીઓના દૂધનો પક્ષાલ કરવાથી પરમાત્મા કઈ રીતે પ્રસન્ન થાય તે વિચારવું રહ્યું.

દિગંબર-શ્વેતાંબરના તીર્થો માટેનો સદીઓથી ચાલ્યા આવતો વિવાદ ક્યારે પૂરો થશે ?

જૈનધર્મમાં ઉપધાન તપને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તેને ‘મોક્ષમાળ’ એટલે કે મોક્ષના દ્વાર સુધી જવાનો એક માર્ગ બતાવવામાં આવ્યો છે. ઉપધાન તપમાં ‘તેલ’ પણ વાપરવું નહીં અને તેની જગ્યાએ ‘ઘી’માં જ દરેક વસ્તુઓ બનાવવી તેવી પ્રથા છે. શાકદાળમાં પણ તેલને બદલે ઘી વાપરવું. સામાન્ય રીતે ઉપધાનમાં એકાસણામાં બહુ બધી મીઠાઈઓ બનતી હોય છે. પરંતુ, અમૂલ્ય ધાર્મિક તપમાં ‘ઘી’ વાપરવાની પ્રથા આજના સમય-સંજોગોમાં પ્રાણીઓ ઉપર અત્યંત દર્દનાક સાબિત થઈ રહી છે.

દરેક ધાર્મિક સંસ્થાએ જે તે દેશના કાયદાઓ-નિયમોનું પાલન કરવાનું હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ આવું કહેલ છે. પરંતુ આજે મોટા ભાગના દેરાસરોમાં અને બીજી ધાર્મિક સંસ્થાઓમાં ‘કાળુંનાણું’ વપરાય છે. ‘બે નંબર’નો હિસાબ ચાલે છે. કરચોરી કરવી તે પણ હિંસા છે. વિવિધ પ્રસંગોએ ‘ઘીની બોલી’માં કરોડો રૂપિયાનું કાળું નાણું વપરાય છે. આ પણ એક મોટી હિંસા છે.

(૮) નાગરિક તરીકેની ફરજ અને વ્યાપાર / વ્યવહાર -

અહિંસા ધર્મને આપણે એક દેશના નાગરિક તરીકેની ફરજ બરાબર બજાવી રહ્યા છીએ કે નહીં તે સાથે પણ નિસ્ખત છે. બીજાના હક્ક છીનવીને કે કાયદાઓનું ઉલ્લંઘન કરીને જીવવું તે પણ હિંસાનો એક પ્રકાર છે. પુરતો ટેક્સ ન ભરવો, લાંચ રુશ્વતથી કારભાર ચલાવવો વગેરે એક રીતે હિંસા જ છે. સમાજ કે દેશને વ્યવસ્થિત

ચલાવવા માટે દરેક નાગરિકે દરેક નિયમોનું પાલન કરવું જોઈએ. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી બીજા લોકોને તકલીફ પડશે.

આપણે શેરબજારમાં સિગારેટ, દારૂ, માંસ, મરઘા ઉદ્યોગ, ડેરી. વિ. કંપનીઓ જે મનુષ્ય, પ્રાણી કે પર્યાવરણને નુકશાન પહોંચાડે તેમાં રોકાણ ન કરીએ.

વ્યાપાર રોજગારમાં ખોટું બોલવું અને ખોટું કરવું તે બીજાને દુઃખ આપવાનું કાર્ય છે. સમાજ-સંબંધીઓની સાથે રોજબરોજના વ્યવહાર, બોલચાલમાં સંયમ અને સમતા રાખવી તે અહિંસાનો અગત્યનો ભાગ છે.

(૯) કેવી હશે અહિંસા - સ્વપ્નનગરી ?

આ અહિંસાનગરીમાં એક જ ધર્મ હોય-અહિંસા. કોઈ ઝઘડા, મારામારી-શાસ્ત્રો-ત્રાસવાદ ન હોય. પશુઓ સ્વતંત્ર હોય. તેમનો કોઈ માલિક ન હોય. દરેક મનુષ્ય અને પ્રાણી પૂર્ણ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય પામે. કોઈનું અકાળ મૃત્યુ ન થાય. જ્યાં કોઈ પણ જીવને ભૂખ-ગરીબી-લાચારી ન સતાવે. બધા મનુષ્યો ધનવાન ન હોય પરંતુ સમૃદ્ધ જરૂર હોય. મનુષ્ય મર્યાદામાં રહે તેથી કુદરત પણ મહેરબાન હોય. કોઈ જીવને કોઈ ફરિયાદ નથી. કોઈ ડરાવતું નથી. નથી કોઈ ડરતું. હાર-જીત નથી. આ નગરી વિષે ઘણું બધું લખી શકાય પરંતુ શબ્દોની મર્યાદા છે. મૌનની તાકાત અસીમ છે. આપ આ સ્વપ્નનગરી વિષે જેટલું વધારે વિચારશો તેટલું અહિંસાનું અમૃત વધારે પામશો.

કહેવાય છે કે... સ્વપ્નો સાચા પડે છે. હા... જરૂરથી સાચા પડે... જો તે શુભ હોય... આપણે તેને સતત જોતા રહીએ. તેનું ધ્યાન ધરીએ. તેને સાકાર કરવાના પ્રયત્ન કરીએ. કોણ કરશે ? કેવી રીતે કરશે ? તેવું વિચારવાને બદલે આપણે દરેક આપણી ક્ષમતા મુજબ કરીએ તો સમગ્ર વિશ્વ અહિંસાનગરી બની જાય અને એક દિવસ શાશ્વત સુખનો સોહામણો સુરજ આપણા દરેકના આંગણે ઊગે.

દરેક જીવ અહિંસાના શાશ્વત સુખને પામે તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. અહિંસા પરમો ધર્મ.

- અતુલ દોશી

૪૧મી વર્ષગાંઠ - સ્નેહમિલન યાત્રાપ્રવાસ

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન મંડળ (ભાચંદર)ની ૪૧મી વર્ષગાંઠ નિમિત્તે તા. ૨૬-૧-૨૦ના રોજ એક દિવસીય ગ્રેટ એસ્કેપ રિસોર્ટ (વિરાર) ખાતેનું યાત્રાપ્રવાસનું આયોજન કરેલ હતું.



સવારે ૭ કલાકે ત્રણ બસ દ્વારા રિસોર્ટ જવા રવાના થયા. રસ્તામાં દરેકે “લોઠા ધામ”, શ્રી સિમંધર સ્વામી જીનાલયનાં દર્શન-વંદન કર્યાં. ત્યાર બાદ ૯ કલાકે રિસોર્ટમાં એન્ટ્રી અને ચા-નાસ્તો કરેલ હતો.

સવારે ૧૦ કલાકે મંડળનું વાર્ષિક-મિલન સમારંભ રાખેલ હતો. વાર્ષિક સમારંભની શરૂઆત શ્રીમતી મધુબેન વારિયા તથા શ્રીમતી જાગૃતિબેન વોરાએ નવકારમંત્રના સ્મરણથી કરેલ હતી. મંડળનાં સમારંભનું સંચાલન શ્રી ધવલ ભણશાલીએ કરેલ હતું.

ત્યાર બાદ યાત્રાપ્રવાસના સહયોગી દાતાઓનું બહુમાન કરેલ હતું. ત્યાર બાદ શૈક્ષણિક ધો. ૧થી ૧૨નાં વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ સમાજમાં મુરબ્બીઓનાં હસ્તે કરેલ હતું. ત્યારબાદ સમાજનાં ઉગ્ર તપસ્વીઓનું બહુમાન શ્રીમતી લીનાબેન તથા શ્રી જયેશભાઈ વસાએ કરેલ હતું. અંતમાં મંડળનાં વરિષ્ઠ સક્રિય કાર્યકર જગદીશભાઈ નરોત્તમદાસ મહેતાએ આભારવિધિ કરેલ હતી. મંડળનાં મુરબ્બીઓએ મંડળને શુભેચ્છા પાઠવી હતી.

અંતમાં રાષ્ટ્રગીત મંડળની બાળાઓ સાથે દરેકે (૨૬જાન્યુઆરી-પ્રજાસત્તાક દિન નિમિત્તે) સાથે ગાઈ સમારંભની પૂર્ણાહૂતિ કરી હતી.

આ વાર્ષિક મિલન માટે મળેલ સહયોગી દાતા

- રત્નસ્તંભ : શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન મંડળ (ભાચંદર) કમિટી
- રજતસ્તંભ : માતૃશ્રી નિર્મળાબેન દિપચંદ વોરાની સ્મૃતિ નિમિત્તે - શત્રુંજય પરિવાર
શ્રીમતી જાગૃતિબેન પરિમલભાઈ મહેતા
શ્રી વૃજલાલ સૌભાગ્યચંદ સાવડિયા પરિવાર
શ્રી ધનેશભાઈ જગજીવનદાસ ધોળકીયા
માતૃશ્રી દક્ષાબેન કાંતિલાલ અમૃતલાલ શાહ પરિવાર
માતૃશ્રી હંસાબેન મનસુખભાઈ મહેતા પરિવાર
શ્રી વસંતરાય નાગરદાસ શેઠ હ. રોહિતભાઈ - હરીશભાઈ
શૈક્ષણિક પ્રથમ પારિતોષિક અનંતરાય શ્રી લવચંદ મહેતાના સ્મરણાર્થે પરિવાર તરફથી (મુલુંડ)
- શૈક્ષણિક દ્વિતીય પારિતોષિક માતૃશ્રી નિલાબેન કિશોરભાઈ મહેતા પરિવાર હ. મિતુલભાઈ
- તપસ્વી બહુમાનનાં લાભાર્થી માતૃશ્રી કાંતાબેન યુનિલાલ વસા પરિવાર હ. જયેશભાઈ

મંડળનો સમારંભ પૂર્ણ થયા બાદ દરેક મેમ્બરોએ સાંજે ૬ વાગ્યા સુધી વોટરપાર્કનો આનંદ માણ્યો હતો. સાંજે લાઈવ ઓર્કેસ્ટ્રા, મિમિકી અને મેજીક શો પણ હતા, જેનાથી લોકો ફેશ થઈ ગયા હતા. સાંજે ૭ વાગ્યે બધાએ બસ દ્વારા ભાચંદર તરફ પ્રયાણ કર્યું હતું.

આ સમારંભ - સ્નેહમિલન યાત્રાપ્રવાસને સફળ બનાવવા માટે જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો છે તે બદલ સમગ્ર કમિટી દરેક સભ્યોનો આભાર માને છે.

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન મંડળ (ભાચંદર) કમિટી

હાર્દિક શ્રદ્ધાંજલિ



સ્વ. શ્રી નવનીતરાય જેચંદ વસા (પાટણવાવવાળા)

જન્મ : તા. ૮-૬-૧૯૪૧ સ્વર્ગવાસ : ૨-૩-૧૯૯૨

રહેવાને સદાય દુનિયામાં કોઈ આવતું નથી

છતાં તમે ગયા એમ કોઈ જતું નથી

વિદાય એવી લીધી કે મન હજી માનતું નથી

નિર્દોષ હસતું મુખડું આપનું નજર સામેથી જતું નથી

જીવન એવું જીવી ગયા કે જીવનારા જોયા કરે

કર્મ એવા કર્યા કે હૃદયમાં સૌનાં ગુંજ્યા કરે

વહાલના વડલા જેવું આપનું જીવનઅસ્તિત્વ તો અમારી વચ્ચે નથી, પરંતુ એ વડલાની શીતળ છાયા સમાન આપના દ્વારા થયેલું જીવનઘડતર અને સંસ્કારોનું સિંચન, સંઘર્ષ પ્રત્યે સકારાત્મક જીવનશૈલી અને સમતાભાવ અમારા માટે પથદર્શક, પ્રેરણાદાયી અને આશીર્વાદરૂપ બની રહે એજ પ્રાર્થના.

લિ.

સ્વ. કુલકુંવરબેન જેચંદ જૂઠાભાઈ વસા પરિવાર

પત્ની	:	પુષ્પાબેન નવનીતરાય વસા	ભાઈ-ભાભી:	પ્રતાપરાય-અરુણાબેન
પુત્રી	:	ડોલી રાજેશ કોરડિયા	ભાઈ-ભાભી:	પ્રમોદભાઈ - દક્ષાબેન
પુત્રી	:	અનિષા અમિત ગાંધી	ભાઈ-ભાભી:	વિનોદભાઈ - આરતીબેન
પુત્રી	:	નિશા કેતન વોરા	પુત્રી:	નેહા જગર શાહ

ભત્રીજી-ભત્રીજા: ડિમ્પલ પારસ વસા - નીકિતા સીજો જોન, જૂલી નીતેશ ભણશાલી

અમી ભાવેશ પટેલ - બિનીત વિનોદભાઈ વસા - હિરલ વિનોદભાઈ વસા

પૌત્ર-પૌત્રી: રીષભ-જય, મિહીર-દેવ, ઈષા, કેવીન, હર્ષ, વિરાજ, પૂજા, રાજ

ફોન : પુષ્પાબેન નવનીતરાય વસા (૦૯૩૨૩૧૭૫૩૭૯)

પ્રામાણિકતાથી મેળવેલી સંપત્તિ : સ્વ-પર માટે કલ્યાણકારી

■ ગુણવંત બરવાળિયા

પૂર્વાચાર્યોએ માર્ગાનુસારિના ગુણોમાં ન્યાયસંપન્ન વૈભવને સ્થાન આપ્યું છે. ન્યાયસંપન્ન વૈભવ એટલે પ્રામાણિકતાથી મેળવેલી સંપત્તિ. જે સંપત્તિ નીતિ, ન્યાય, અન્યાયનું શોષણ કર્યા વિના, બીજાને પીડા આપ્યા વિના, હક્કની સંપત્તિ મેળવી હોય તે પ્રામાણિકતાથી સંપન્ન કરી કહેવાય. ન્યાયસંપન્ન વૈભવની ભાવના ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં અભિપ્રેત છે.

જે માયા, કપટથી રહિત હોય, અહિંસક હોય, અન્યની પરિસ્થિતિનો વિચાર કરીને મેળવેલી સંપત્તિ જ સ્વ-પરનું કલ્યાણ કરી શકે. સત્યના આધારે નિર્વાહ કરતી વ્યક્તિનું જીવન સત્વશીલ હોય છે.

વિક્રમ સંવત ૧૭૪૦માં કાઠિયાવાડ અને ગુજરાતના મોટા ભાગમાં દુષ્કાળ પડ્યો. વરસાદ માટે પ્રાર્થનાઓ યોજાઈ. ગુજરાતનરેશે યજ્ઞો કર્યા, પરંતુ વરસાદ ન આવ્યો, પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ. મૂગાં પશુઓ પાણી માટે તલસવા લાગ્યાં. કેટલાક શાણા માણસોએ રાજાને કહ્યું કે, “આપણા રાજ્યનો એક વેપારી જો ધારે તો વરસાદ લાવી શકે.” રાજા તે વેપારી પાસે ગયા અને કહ્યું કે, “તમે પ્રભુને પ્રાર્થના કરી વરસાદ લાવો.” વેપારીએ નમ્રતાપૂર્વક કહ્યું કે, “હું તો એક નાનકડો વેપારી છું. મારી પ્રાર્થનાથી શું થશે? કોઈ મોટા સાધુ-સંત, ભક્ત, મહંત પ્રાર્થના કરે કે યજ્ઞ કરવામાં આવે તો વરસાદ આવે.” રાજાએ કહ્યું, “અમે બધા પ્રયત્નો કર્યા છે. સમગ્ર રાજ્ય વતી હું આપને પ્રાર્થના કરું છું કે ભૂખ્યા પ્રજાજનો અને અબોલ પશુઓ પર દયા કરી આપ પ્રભુ પાસે વરસાદ માગો.”

રાજાની વિનંતીથી આખરે વેપારીએ ભગવાનને પ્રાર્થના કરી. તેણે પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને આકાશ સામે જોઈને કહ્યું કે, “જો આ ત્રાજવાથી મેં ક્યારેય કોઈને ઓછું-અધિક તોળી દીધું ન હોય તો, નીતિનું જ સેવન કર્યું હોય તો, સત્યનું જ આચરણ કર્યું હોય તો હે દેવતાઓ તમે અનુગ્રહ કરજો, મેઘરાજ અમારું કલ્યાણ કરવા પધારો.” હજુ વેપારી એ પ્રાર્થના પૂરી કરે એટલામાં વાદળાં ઘેરાવાં લાગ્યાં અને થોડી વારમાં મેઘરાજાની મહેર થઈ. પ્રામાણિકતા અને ન્યાયસંપન્નતાથી પરમતત્ત્વો પણ વશમાં વર્તે છે.

સંત ગુરુ નાનક ફરતાંફરતાં એક નાનકડા શહેરમાં પહોંચ્યા. ત્યાં એક શેઠ રહેતા હતા. તેમને ઘરે એક ભોજન સમારંભ હતો. તેમણે ઘણા સાધુબાવા, સંતો, ફકીરો, ઓલિયા પીરને જમવાનું આમંત્રણ આપેલું. તેમણે નાનકજીને પણ આમંત્રણ મોકલ્યું. જમવા સમયે નાનકજી ન આવ્યા, એટલે શેઠ ફરી વાર માણસને બોલાવવા મોકલ્યો, તોપણ નાનકજી ન આવ્યા-જેથી શેઠને થયું કે નાનકજી જેવા વિખ્યાત સંત મારે ત્યાં આવે તો મારી વાહવાહ થઈ જાય જેથી પોતે બોલાવવા ગયા. સંતે શેઠને કહ્યું કે, “હવે બહુ મોડું થઈ ગયું છે તો હું તમારે ત્યાં ભિક્ષા લેવા નહીં આવું. અહીં જે ટુકડો મળશે તે ખાઈ લઈશ.”

શેઠને થયું, મારી ઈજ્જતનો સવાલ છે, જેથી તેણે અનુચરોને પોતાને ત્યાંથી ભોજનનો થાળ લાવવાની આજ્ઞા કરી. એટલામાં લાલજી નામનો એક ગરીબ ભક્ત ભોજનનો થાળ લઈને આવ્યો. ગરીબ લાલો બે ગાય રાખીને થોડી મજૂરી કરી, થોડું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. થોડા દૂધમાંથી છાશ બનાવી પોતે ઉપયોગ કરે અને બીજા ગરીબોને મફત આપે અને સંતોની ભક્તિ કરે. ભોજનમાં તે છાશ-રોટલો લાવેલો.

એટલામાં શેઠના માણસો પકવાન ભરેલો ભોજનનો થાળ લઈ આવ્યા. નાનકજી એ રોટલો ને છાશ ખાવા લાગ્યા. શેઠે કહ્યું કે, “મારા પકવાનનો થાળ આરોગો.” ગુરુ નાનકે એક હાથમાં રોટલો અને બીજા હાથમાં પકવાન લીધું. રોટલામાંથી દૂધની ધાર થઈ અને પકવાનમાંથી લોહીની ધાર છૂટી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા! શેઠ પણ દંગ થઈ ગયા. શેઠે કહ્યું, “આમ કેમ?” સંતે કહ્યું, “આની થોડી લક્ષ્મી છે, પણ મહાલક્ષ્મી છે. તેથી આનું અન્ન પવિત્ર છે. નીતિ-ન્યાયથી શ્રમ કરીને મેળવ્યું છે અને ભક્તિભાવથી પીરસ્યું છે. આ ઉપનય કથાનો દૂધનો રોટલો ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે.

“આપ ધીરધારના ધંધામાં ગરીબો પાસેથી જે વધુપડતું વ્યાજ લો છો તેનાથી લાચાર ગરીબોનું શોષણ થાય છે. ગરીબોના લોહી ચૂસીને એકઠી કરેલી સંપત્તિ દ્વારા તમારા અહંને પોષવા તમે આ પકવાન પીરસ્યું છે, તેથી લોહીની ધાર થઈ છે.” આ પ્રસંગથી શેઠના જીવનનું પરિવર્તન થઈ ગયું.

ભાવભીની શ્રદ્ધાંજલિ



સ્વ. સૂર્યકાન્ત મનસુખલાલ લાલચંદ વોરા

જન્મ : તા. ૧૩-૮-૧૯૪૩ - સ્વર્ગવાસ : તા. ૫-૩-૨૦૧૭

(ધોરાજી, હાલ : બોરીવલી)

શૂન્યમાંથી સર્જન કરી,

સેવા, સમપૂર્ણ, નીડરતાની સાક્ષાત મૂર્તિ,

અમૃત ભરેલા અંતરવાળા, સાગર જેવા વિશાળ દિલવાળા,

કુટુંબ, સગા તથા સ્નેહીને સદાય ઉપયોગી રહી,

વિશાળ વડલાની જેમ પોતાની છાયામાં

આવતા સર્વોને વિસામો આપતા

કર્મયોગી વડિલ....

પરમ કૃપાળુ પરમાત્મા તમારા દિવ્ય આત્માને

શાંતિ પ્રદાન કરે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના...

શ્રદ્ધાંજલિ સહ....

પિતાશ્રી : સ્વ. મનસુખલાલ લાલચંદ વોરા માતા : સ્વ. જયાકુંવર મનસુખલાલ વોરા

પત્નિ : પ્રવિણાબેન પુત્ર : ચિંતન પુત્રી : ચૈતાલી

ભાઈ : હસમુખ ભાઈના પત્નિ : મધુબેન ભત્રીજા : જય, મિતેશ ભત્રીજા વહુ : રીના

બહેનો : સ્વ. અનસૂયાબેન, સ્વ. ભાનુબેન, કુસુમબેન, પ્રતિભાબેન, જ્યોત્સનાબેન, હીતાબેન

સસરા : સ્વ. નગીનદાસ નેણશી મહેતા સાસુ : સ્વ. કંચનબેન નગીનદાસ મહેતા

સમસ્ત વોરા પરિવાર તથા મહેતા પરિવારનાં જય જિનેન્દ્ર

સંયમનું મહત્વ

■ પારુલબેન ગાંધી

એક ભિખારી કેટલાય ઘરે ભટક્યો છતાં ખાવાનું ન મળ્યું. લાગલાગટ ત્રણ દિવસનો ભૂખ્યો આ ભિખારી એક શેઠની પેઢી જોઈ તેથી તેની પાસે ભોજન માગવા ગયો. શેઠે તેને ધુત્કારી કાઢી મૂક્યો. એટલામાં જ એક જ્ઞાની, લબ્ધિધારી સંત એ શેઠને ત્યાં ગૌચરી માટે પધાર્યા. શેઠે તેમને જોયા તો બહુમાનપૂર્વક પોતાને ઘરે લાવ્યો અને અનેક પ્રકારનાં દ્રવ્યો સહિત ગૌચરી વહોરાવી, બહાર તેમને સન્માનપૂર્વક વળાવવા ગયો.

પેલો ભિખારી બહાર ઊભોઊભો જોતો હતો. જેવા સંત ગૌચરી લઈને આગળ વધ્યા એટલે તે તેની પાસે ગયો. તેમની પાસે જઈ કહેવા લાગ્યો કે, “આપની પાસે ઘણું ભોજન છે. હું ત્રણ દિવસનો ભૂખ્યો છું. આપ આપની પાસેના ભોજનમાંથી થોડુંક ભોજન મને આપો, તો મારી ભૂખ ખોડી શાંત થઈ જાય.”

મુનિ જ્ઞાની અને લબ્ધિધારી હતા. ભિખારીનો ચહેરો જોઈ તેણે જ્ઞાનથી ઉપયોગ મૂક્યો કે આ ભવ્ય જીવ છે, સરળ છે, પરંતુ અત્યારે ભૂખથી અત્યંત પીડિત છે. જો તે દીક્ષા લેશે તો તેના આત્માનું કલ્યાણ થઈ જશે. આથી સંતે ભિખારીને કહ્યું કે, “અમે જૈન સંત છીએ, અમને મળેલી ભિક્ષા અમે માત્ર અન્ય સંતોને જ આપી શકીએ. તમે મારી સાથે ચાલો. મારા ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી લો તો મારી પાસેનું બધું જ ભોજન આપને આપી દઈશ.” પેલો ભિખારી તો ભૂખનો માર્યો ખરેખર સંત સાથે ગયો. તેણે સાધુનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. સંતે પોતાના ગુરુને પોતાના જ્ઞાન તેમ જ ઉપયોગની વાત કરી ભિખારીને દીક્ષા દેવા વિનંતી કરી. ગુરુદેવે ભિખારીની ઈચ્છા જાણીને દીક્ષા આપી.

હવે દીક્ષા પછી આચાર્યની આજ્ઞાથી સંતે ભોજન પેલા ભિખારીની સામે રાખી દીધું. ભિક્ષામાં આવેલ લાડવા તેમ જ અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું પહેલી વાર તેને મળ્યું હતું. એમાંય ત્રણ દિવસની ભૂખ, આથી પેલા મુનિએ ભરપેટ ખાવાનું ખાધું. રાત્રિભોજન અને પાણીનો ત્યાગ હોય તેનો તેને અનુભવ ન હોય. પૂરતી માત્રામાં પાણીનો ઉપયોગ ન કરી શક્યા. રાત્રે ભૂખ્યા પેટે, અતિશય ખોરાક ખાવાને કારણે પેટનો ભયંકર દુઃખાવો ઊપડ્યો.

શ્રાવકોને ખબર પડતાં બધા જ મુનિરાજની સેવામાં હાજર થઈ ગયા. જે શેઠે તેને ધુત્કારીને કાઢી મૂક્યા હતા, તે શેઠ પણ તેમની સેવામાં ખડે પગે હાજર હતા. આ બધી સ્થિતિ જોતાં

નવદીક્ષિત મુનિના વિચારોમાં પરિવર્તન આવ્યું. તેમણે વિચાર્યું કે માત્ર ભૂખના દુઃખથી બચવા મેં દીક્ષા લીધી તોપણ તેનો કેટલો મહિમા છે કે આવા મોટા શેઠ અને શ્રાવકો ખડે પગે સેવા કરે છે. જો મેં ઉચ્ચ ભાવે, આત્મકલ્યાણ માટે સંયમ ગ્રહણ કર્યો હોત તો મને કેટલો લાભ થાત.

આમ તેના મનમાં સંયમ પ્રત્યે ખૂબ શ્રદ્ધા અને બહુમાન થયાં. આવા ભાવમાં ને ભાવમાં જ તેઓ કાળધર્મ પામ્યા. જો કે સંયમ તેણે ક્ષુધાશાંતિ માટે જ લીધો હતો. આમ છતાં અંતિમ સમયે તેમના મનના ભાવો દીક્ષા પ્રત્યે ઉત્કૃષ્ટ થયા તેથી તેમનો જીવ ત્યાં આયુષ્ય પૂર્ણ કરી સમ્રાટ અશોકના પૌત્ર કુણાલને ત્યાં રાજકુમારરૂપે ઉત્પન્ન થયો. જે પાછળથી મગધસમ્રાટ મહારાજ સંપ્રતિ બન્યા. જેમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરીને પોતાનું શેષ જીવન જિન શાસનની પ્રભાવનામાં સમર્પિત કર્યું.

જે આચાર્યભગવંતે તેમને પૂર્વભવમાં દીક્ષા આપેલી. તેઓ વિચરતાંવિચરતાં મહારાજ સંપ્રતિના રાજ્યમાં પધાર્યા. તેમને જોઈને મહારાજ સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાન થયું. તેઓ પોતાના ઉપકારીને ઓળખી ગયા. તેમણે રાજ્ય તેમનાં ચરણે સમર્પિત કરતાં કહ્યું કે, “આ બધો આપની કૃપાનો પ્રભાવ છે? આચાર્યભગવંતે સાધુમર્યાદા બતાવી રાજ્ય લેવાની ના પાડી અને તેને ધર્મોપદેશ આપ્યો. આ જ ઉપદેશના પરિણામ ફરી તે જૈન ધર્મના અનુયાયી બન્યા, મોટી સંખ્યામાં મંદિરો બનાવ્યાં, મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી, જૈન ધર્મનો ખૂબ પ્રચાર કર્યો.

આ વાત એ સમજાવે છે કે, ‘જો દ્રવ્યસંયમ પણ ઉત્કૃષ્ટ ભાવસંયમમાં પરિવર્તિત થાય તો ભટકતો ભિખારી મગધસમ્રાટ સંપ્રતિ બની જાય છે, તો જે માત્ર ને માત્ર આત્માના લક્ષે, આત્મકલ્યાણ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યથી ભાવસંયમ ગ્રહણ કરે તેને સિદ્ધગતિ કે દેવલોકના ઈન્દ્રનું સ્થાન પ્રાપ્ત થાય તેમાં શું નવાઈ છે ?

સંયમ ઉત્કૃષ્ટ ભાવે લઈ ઉત્કૃષ્ટ ભાવે જ પાળવો.

ગમ્મત ગુલાલ

શ્રીમતી હીનાબેન મનહરભાઈ શાહ-થાણા

ગમ્મત ગુલાલ નં. ૧ :

૫૦૦ ની સંખ્યાવાળા પ્રશ્નો.

- ૧) ૫૦૦ ધનુષની કાયા કયા તીર્થકરની ?
- ૨) ૫૦૦ ધનુષની કાયાવાળા બે ભાઈ કોણ ?
- ૩) ૫૦૦ ધનુષની કાયાવાળા બે બહેનો કોણ ?
- ૪) ૫૦૦ યોજન વિસ્તારવાળુ વન કયું ?
- ૫) ૫૦૦ સિંહાસન કયા મંત્રીએ બનાવ્યા ?
- ૬) ૫૦૦ ગામોનો સ્વામી કયા રાજા ?
- ૭) ૫૦૦ જિન મંદિરો કઈ નગરીમાં હતા ?
- ૮) ૫૦૦ ચોરો ને કોણે પ્રતિબોધ પમાડેલ ?
- ૯) ૫૦૦ શિષ્યો ક્યાં ગણધર ને હતા.
- ૧૦) ૫૦૦ યોજન ઊંચાઈ કયા વિમાનની ?
- ૧૧) ૫૦૦ અખંડ આયંબિલની આરાધના પૂર્વ ભવમાં કઈ સતીએ કરી.
- ૧૨) ૫૦૦ પાડા નો વધ કરનાર ?
- ૧૩) ૫૦૦ શિષ્યો કયા આચાર્યના ધાણીમાં પીલાયા.
- ૧૪) ૫૦૦ પંડિતો કયા રાજાની સભામાં આવતા.
- ૧૫) ૫૦૦ આચાર્યો કોના સંઘમાં હતા ?
- ૧૬) ૫૦૦ વહાણો ને કોણે ચલાવ્યા ?
- ૧૭) ૫૦૦ શ્લોક એક જ રાત્રીમાં કોણે કંઠસ્થ કરેલ.
- ૧૮) ૫૦૦ ચૌદપૂર્વીઓ કયા ભગવાનને હતા.
- ૧૯) ૫૦૦ સાગરોપમનું પાપ કેવી રીતે નાશ પામે ?
- ૨૦) ૫૦૦ જાતના વાંજિત્ર કયા શેઠ પાસે હતા ?

ગમ્મત ગુલાલ નં. ૨

બ્યુટી... સુંદરતા ને આધારે જવાબ આપો.

- ૧) માથાના સફેદવાળ જોઈને કોણ વૈરાગ્ય પામ્યા.
- ૨) એક પગનું આભૂષણ અને મુનિનું નામ.
- ૩) પત્નીને શણગારતા શણગારતા કેવલ જ્ઞાન.
- ૪) એક છોકરીનું નામ અને સુંદરતામાં વધારો કરનાર.
- ૫) રાજિમતીના રૂપમાં ભાન ભૂલ્યા.
- ૬) અવસર્પિણી કાળના પ્રથમ શ્રાવિકા.
- ૭) નટડીના રૂપના કારણે નાયતા નાયતા કેવલ જ્ઞાન.
- ૮) દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કોણ ?
- ૯) એક આભૂષણ જેના નામ ને ઊંધો કરવાથી થાય મનોરંજનનું

- ૧૦) રૂપનો મદ કોણે કર્યો.
- ૧૧) કોના રૂપમાં પાગલ બની ભાઈએ ભાઈનું ખૂન કર્યું.
- ૧૨) શ્રીપાળરાજાએ જ્યાં વીણા વગાડી વિવાહ રચ્યો.
- ૧૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામ અને એક આભૂષણ.
- ૧૪) ભરત મહારાજાનું કેવલ જ્ઞાનનું કારણ.
- ૧૫) એક કંકણના અવાજથી વૈરાગ્ય પામ્યા.

ગમ્મત ગુલાલ નં. ૩

ચાલો શોર્પીંગ કરવા મુંબઈ. કલુ પરથી નામ કહો.


- ૧) બ્યુટી આર્ટ.
- ૨) કસબ ઘર.
- ૩) પ્રેમાળ છોકરાઓ.
- ૪) રાણીનું મહેલ.
- ૫) મેળાપ થાય તો સારું.
- ૬) શહેરમાં ચાલતાં ચાલતાં.
- ૭) મોટી માર્કેટ.
- ૮) જીવનની અદા.
- ૯) પશ્ચિમ બાજુ.
- ૧૦) રેશમી ખજાનો.
- ૧૧) આપણું પોતાનું.
- ૧૨) સલીમના પિતાની દુઆ.
- ૧૩) સપના નો ખજાનો.
- ૧૪) કયુ પછી આવતું શહેર.

ગમ્મત ગુલાલ નં. ૪

ચાર શબ્દોમાંથી એક શબ્દ ખોટો છે તે જણાવો.

- | | | | |
|------------|--------|---------|------------|
| ૧) સૂર્ય | તારા | નક્ષત્ર | ચંદ્ર |
| ૨) ગાય | કૂતરો | બકરી | વાઘ |
| ૩) બરફી | સમોસા | પેંડા | લાડુ |
| ૪) પોરબંદર | નાગપુર | રાજકોટ | અમદાવાદ |
| ૫) હાથ | પગ | નાક | આંતરડુ |
| ૬) સફરજન | વટાણા | પપૈયુ | કેરી |
| ૭) મોગરો | ચમેલી | જાસુદ | ગુલાબજાંબુ |
| ૮) સીતા | સરોજ | સરસ્વતી | શારદા |
| ૯) કૃષ્ણ | રામ | ભરત | લક્ષ્મણ |
| ૧૦) ૮૧ | ૨૫ | ૧૦૮ | ૫૪ |

ગમ્મત ગુલાલ નં. ૧




ગમ્મત ગુલાલ

આ રમતમાં ૧૨ ચાવી આપેલ છે. તે ઉકેલી ને જવાબ આપવાના છે. પ્રત્યેક જવાબ પાછળ વાર શબ્દ આવવો જોઈએ. સવાલ સામે કેટલા અક્ષરનો જવાબ છે તે સંખ્યા લખેલી છે.

૧. ગુરુવારનો સંસ્કૃત શબ્દ ? ૬
૨. એક શાકભાજી ? ૩
૩. ઉત્સવ-પર્વ-સારો દિવસ ? ૪
૪. પુષ્કળ... અઢળક... અગણિત....? ૪
૫. બધા સાથે બેસીને ભોજન કરે તે ? ૫
૬. યુદ્ધ કરવા માટે હાથમાં રખાતું શસ્ત્ર ? ૪
૭. પ્રાતકાળ... પરોઢ... વહાણું....? ૩
૮. એક અનાજનું નામ.....? ૩
૯. ઘોડા પર બેસીને મુસાફરી કરે તેને શું કહેવાય ? ૪
૧૦. સંબંધ... વર્તન... વહીવટ... આચાર....? ૪
૧૧. કુટુંબ-કબીલાને ક્યા નામે સંબોધાય ? ૪
૧૨. સેવા... ચાકરી... ઈલાજ.....? ૪

શ્રીમતી પ્રતિભાબેન પ્રવીણભાઈ શાહ - મુલુંડ

ગમ્મત ગુલાલ નં. ૨



નીચે આપેલ પ્રશ્નોના જવાબ સંખ્યામાં કહો :

- ૧) સામાયિકની મિનિટ
- ૨) અનુતર વિમાનની સંખ્યા
- ૩) કાયાના દોષ
- ૪) શલાકા પુરુષ
- ૫) મૂળસૂત્ર
- ૬) જ્યોતિષીના ઈન્દ્રો
- ૭) પાપ સ્થાનક

૮) એક ઘડીની મિનિટ

૯) એક દિવસમાં વધુમાં વધુ સામાયિક

૧૦) ગણધરના ગુણ

૧૧) એક કાળચક્રના તિર્થંકર

૧૨) આશાતના

૧૩) લોકાંતિક દેવ

૧૪) બ્રહ્મચર્યનીવાડ

૧૫) કાઉસગ્ગના આગાર

૧૬) વંદનના પ્રકાર

૧૭) ધનધાર્તિ કર્મ

૧૮) તિર્થંકરના અતિશય

૧૯) સ્ત્રીઓની કળા

૨૦) શ્રાવકના ગુણ

૨૧) ભય

૨૨) ગતિ

૨૩) મહાવીર સ્વામીનું આયુષ્ય

૨૪) શરણા

શ્રીમતી શિલ્પાબેન ચંદ્રકાંત શાહ - થાણા

શ્રી જિનેશ્વરની પુજા ભક્તિનું મહત્વ

- ૧) જિનેશ્વરની પુજા કરવાથી આઠેય કર્મનો નાશ થાય છે.
- ૨) ચૈત્યવંદન કરવાથી જ્ઞાનાવરણીય કર્મ નાશ થાય છે.
- ૩) પ્રભુજીના દર્શન કરવાથી દર્શનાવરણીય કર્મ નાશ થાય છે.
- ૪) પુજા કરવામાં જયણા પાળવાથી અશાતાવેદનીય નાશ થાય છે.
- ૫) પ્રભુજીના ગુણગાનથી મોહનીય કર્મ નાશ થાય છે.
- ૬) શુદ્ધ અધ્યવસાય (ભાવ) થી આયુષ્ય કર્મ નાશ થાય છે.
- ૭) પ્રભુજીના સ્મરણથી અશુભ કર્મનો નાશ થાય છે.
- ૮) પ્રભુજી ને વંદન પુજન થી નીચ ગોત્ર નાશ થાય છે.
- ૯) યથાશક્તિ દ્રવ્ય વાપરવાથી અંતરાય કર્મ ક્ષય થાય છે.

શ્રીમતી શિલ્પાબેન ચંદ્રકાંત શાહ - થાણા

ગમ્મત ગુલાલનો ઉત્તર આવતા અંકમાં વહેલા તે પહેલા ધોરણો ઓફિસના સરનામે મોકલી આપો.
સાચા ઉત્તરને ૧૦૦/- ઈનામ આપવામાં આવશે.

હસ્તરે ખા

ઈન્ટરવ્યૂ લઈ લીધા પછી મેનેજર થોડીવાર એ યુવાનને જોઈ રહ્યા પછી અચાનક કહ્યું: ‘હવે તમે જઈ શકો છો’

ઈન્ટરવ્યૂ આપવા આવેલો યુવાન ‘જી સર’ કહીને ધીમેથી ઉઠ્યો અને મેનેજરની કેબિનની બહાર નીકળી ગયો.

કંપનીએ ખાલી પડેલી જગ્યા ભરવાની જાહેરાત એક અઠવાડિયા પહેલાં આપી હતી. નોકરીની જગ્યા એક હતી અને એના માટે સાત ઉમેદવારના ઈન્ટરવ્યૂ લીધા. છેલ્લા ઉમેદવાર સિવાયના છએ જણે, પોતાની પાસે વિશિષ્ટ આવડતો છે, પોતે નિષ્ઠાથી કામ કરશે, એવું પૂછવામાં આવ્યું ન હતું તોય કહેલું. સાતમો ઉમેદવાર વધારાનો એક પણ શબ્દ બોલ્યો ન હતો. એને જે પૂછવામાં આવ્યું તેના તેણે મુદ્દાસર અને સચોટ ઉત્તર આપ્યા. ઈન્ટરવ્યૂ પૂરો થઈ ગયા પછી સાતેયને બેસવાનું કહેવામાં આવ્યું હતું. વેઈટિંગ રૂમમાં બેઠેલા છ ઉમેદવારો અંદરોઅંદર ચર્ચા કરતા હતા. છએ જણનું કહેવું હતું કે નોકરી તો મને જ મળશે. સાતમો ઉમેદવાર મોઢામાં જીભ જ ન હોય તેમ ચૂપ બેઠો હતો. તે દેખાવે પણ પેલા છ જણથી અલગ પડી જતો હતો. એના કપડાં સુઘડ હતાં, પણ મોંઘા ન હતાં. તેણે પગમાં બૂટને ઠેકાણે સાદા ચંપલ પહેર્યા હતા. એ કંઈ બોલતો ન હતો એટલે બાકીના છ જણ એની મશકરી કરતા હોય એવું એને લાગ્યું, પણ તેણે એમના તરફ ધ્યાન ન આપ્યું.

થોડીવારે મેનેજરની ઓફિસનો પટાવાળો આવ્યો, અને ત્યાં બેઠેલા ઉમેદવારો પર નજર ફેરવી બોલ્યો: ‘તમારામાં શૈલેશકુમાર કોણ છે?’

પોતાનું નામ સાંભળીને ચમક્યો હોય તેમ પેલા સાતમા ઉમેદવારે કહ્યું: ‘મારું નામ શૈલેશકુમાર છે.’

‘તમને મેનેજર સાહેબે બોલાવ્યા છે. કેબિનમાં આવો’ કહીને પટાવાળો ચાલ્યો ગયો.

જેનું નામ શૈલેશકુમાર હતું તે સાતમા ઉમેદવારે પોતાની ફાઈલ ઉપાડી, બધા સામે હસવા જેવું મોં કર્યું. બાકીના એને નવાઈથી જતો જોઈ રહ્યા.

‘મે આઈ કમ ઈન સર?’ એ યુવાને જરા નમીને અંદર આવવાની રજા માગી.

મેનેજરે આંખના ઈશારાથી અંદર આવવાનું કહ્યું. પેલો યુવાન સંકોચ સાથે ઊભો રહ્યો.

‘પ્લીઝ સીટ ડાઉન’ મેનેજરે કહ્યું. જરાય અવાજ ન થાય તેવી રીતે એ યુવાન ખુરશી પર બેઠો. એને એ સમજાયું નહીં કે તેને બીજીવાર શા માટે બોલાવવામાં આવ્યો હતો. મેનેજરે કહ્યું: ‘મિસ્ટર ચાવડા, મારે તમારી સાથે હજુ પણ કેટલીક વાતચીત કરવી છે. એટલે જ તમને ફરી બોલાવ્યા છે.’

‘જી સર.’

‘તમે જાણો જ છો કે, નોકરીની જગ્યા એક છે, અને તમે સાત જણ આવ્યા છો. અમે કોઈ એકને જ નોકરી આપી શકશું. આ નોકરી તમને જ મળવી જોઈએ, એવું તમને પૂછવામાં આવે તો તમે શો જવાબ આપશો?’

પેલો યુવાન સહેજ ટક્રાર થયો. તેણે જરાય નજર ચોર્યા વગર કહ્યું: ‘આપ જે જાણવા માગો છો તે હું ન કહું તો પણ મને નોકરી આપશો સર?’

મેનેજરને આ યુવાનનો ચતુરાઈભર્યો જવાબ ગમ્યો. મેનેજરે આ કંપનીમાં કેટલાય ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લીધા હતા. એમને કેટલાય અટપટા સવાલો પૂછ્યા હતા, પણ આવો ઉત્તર દેનાર આ યુવાન પહેલો હતો. મેનેજરના હોઠ પર સ્મિત આવ્યું. તેમણે બીજો પ્રશ્ન મૂક્યો: ‘મિસ્ટર ચાવડા, તમે અહીં નોકરી મેળવવા આવ્યા છો. તમને તમારી વાત કહેવાની તક આપવામાં આવે છે. સમજો છો તમે?’

એ યુવાને એક ઊંડો શ્વાસ ભર્યો. બોલવું કે ન બોલવુંની એક મૂંઝવણ તેના મોં પર દેખાઈ ગઈ. મેનેજરની પડખે અધિકારી જેવા લાગતા બે જણ બેઠા હતા. એ ત્રણેય વચ્ચે પોતાની બાબતમાં ચર્ચા થઈ છે એવું તે સમજી ગયો. તેણે જરાય ગભરાયા વગર કહ્યું.

‘સર, હું સમજી ગયો છું કે આપ શું જાણવા માગો છો, પણ કદાચ હું એ નહીં કહી શકું તો માફ કરશો?’

‘અમે જાણવા માગીએ તો પણ નહીં કહો? ઠીક છે, ચાલો તમને નોકરી મળે તો સૌથી વધુ આનંદ કોને થશે?’

‘સર મારા મા-બાપ અને મારી બેય બહેનોને. જેમણે મારા માટે ખૂબ ભોગ આપ્યા છે.’

‘કેમ તમને શા માટે નહીં થાય? મેનેજર યુવાન સામે તાકી રહ્યા.

‘મારા આનંદને હું ઋણ ઉતારવાની તક ગણું છું.’ યુવાન જરા ઉદાસ થઈ ગયો.

‘અચ્છા? એવું શા માટે?’ મેનેજરે પૂછ્યું. પહેલીવાર એ યુવાન જરા ખૂલીને મલક્યો. તેણે કહ્યું.

‘સર, સમજું છું કે હું જે કહેવા માગતો નથી, એજ તમે જાણવા માગો છો, પણ જ્યારે તમે મારા જેવા એક સામાન્ય માણસમાં આટલો રસ લઈ રહ્યા છો ત્યારે મારી કહી જ દેવું જોઈએ. મને એટલા માટે કહેવાનું નહોતું કે મારી સ્થિતિ એ મારી અંગત બાબત છે. હું મારી ગરીબી અને લાચારીને મારી નોકરીની લાયકાત બનાવવા માગતો ન હતો. મારો પરિવાર સાવ સામાન્ય સ્થિતિમાં રહે છે. મારા પિતાજીને શ્વાસની બીમારી છે, મારી મોટી બહેન એટલા માટે પોતાની સગાઈ થવા દેતી નથી કે જો લગ્ન થઈ જાય તો પિતાજીને મદદ નહીં કરી શકે. બીજી બહેન છ કલાક ટ્યુશન કરે છે. આ બધી મારી લાચારીઓ છે. જે હું

તમને કહેવા માગતો ન હતો. મારી લાચારીઓ બતાવીને હું નોકરી મેળવવા માગતો ન હતો. સર, મને આશા છે કે મને માફ કરશો.

મેનેજરના અવાજમાં લાગણી તરી આવી.

‘સોરી મિસ્ટર ચાવડા, હું તમને શરમિંદો બનાવવા માગતો ન હતો, પણ હું ખાતરી કરવા માગતો હતો કે મારી છટ્ટી ઈન્દ્રીય મને દગો તો નથી દેતી ને?’

‘હું સમજ્યો નહીં સર.’

‘મિસ્ટર ચાવડા તમારાથી પહેલાં છ જણ અહીં આવી ગયા. લાયકાત તમારા બધાની સરખી છે. પણ તમારા અવાજમાં મને સચ્ચાઈ અને ઈમાનદારી જણાઈ. હું સમજી ગયો કે તમે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા હશો. તમને નોકરીની ખાસ જરૂર છે. એ વાતની ખાતરી કરવા જ તમને ફરી બોલાવ્યા. હા, એક વાત એ પણ જણાવી દઉં કે સાતેયમાં તમે એકમાત્ર એવા ઉમેદવાર છો, જેને નોકરી આપવા માટે કોઈની ભલામણ આવી નથી. મને વિશ્વાસ છે કે તમે નિષ્ઠાથી કામ કરશો. બોલો ક્યારથી હાજર થશો?’

યુવાનનો ચહેરો ખીલી ઉઠ્યો. તેણે થોડીવાર આંખો બંધ કરી તો, એને મેલાં કપડાવાળા બાપુજી, કામેથી થાકીને આવતી મા, સાવ સાદી સાડીમાં નોકરી કરવા જતી બહેન, અને સગવડો વગરનું પોતાનું ઘર દેખાયું. એની આંખોના ખૂણા ભીના થઈ ગયા. તેણે આભારવશ થઈને મેનેજર સામે જોતાં કહ્યું:

‘સર, આ દિવસને હું કદી નહીં ભૂલું, અને તમારી માણસપારખુ નજર પણ હંમેશાં યાદ રહેશે.’

‘મિસ્ટર ચાવડા, દુનિયામાં હજી બધું ખાડે ગયું નથી હો.’

‘અનુભવી રહ્યો છું સર.’

કોમ્પ્યુટરના પ્રિન્ટરમાંથી એક નિમણૂક પત્ર બહાર આવી રહ્યો હતો.

રજિસ્ટ્રેશન ઓફ ન્યૂઝપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬ અન્વયે
'સોરઠ વિશાશ્રીમાળી' પત્ર અંગેની માહિતી
ફોર્મ નં. ૪ (જુઓ રૂલ નં. ૮)

૧. પ્રકાશનનું સ્થળ : શ્રી તારાચંદ ધનજી મહેતા કાર્યાલય, દેવકરણ મેન્શન બિલ્ડિંગ નં. ૭, બીજા માળે,
વિક્લદાસ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨.
૨. પ્રકાશનની સામયિકતા : માસિક
૩. મુદ્રકનું નામ : નીતિન જે બદાણી - અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ, પંતનગર, ઘાટકોપર, મુંબઈ-૪૦૦ ૦૭૫.
રાષ્ટ્રીયતા : ભારતીય
સરનામું : ૩૨, સિંઘ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-૩, પહેલે માળે, રામ મંદિર રોડ,
ગોરેગામ (વે), મુંબઈ-૪૦૦ ૧૦૪.
૪. પ્રકાશકનું નામ : સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ વતી.
કીર્તિબેન મયુરભાઈ મહેતા
રાષ્ટ્રીયતા : ભારતીય
સરનામું : દેવકરણ મેન્શન બિલ્ડિંગ નં. ૭, બીજા માળે, વિક્લદાસ રોડ, મુંબઈ-૪૦૦૦૦૨.
૫. તંત્રીનું નામ : કીર્તિબેન મયુરભાઈ મહેતા
રાષ્ટ્રીયતા : ભારતીય
૬. માલિકનું નામ : મહેશભાઈ મયુરભાઈ સાવડીયા (પ્રમુખ)
શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ
સરનામું : શ્રી તારાચંદ ધનજી મહેતા કાર્યાલય, દેવકરણ મેન્શન, બિલ્ડિંગ નં. ૭, બીજા માળે,
મંગલદાસ રોડ, મુંબઈ-૪૦૦૦૦૨

હું કીર્તિબેન મયુરભાઈ મહેતા આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગત મારી જાણ અને માન્યતા મુજબ સાચી છે.

તા. ૧-૩-૨૦૨૦

પ્રકાશકની સહી - કીર્તિબેન મયુરભાઈ મહેતા (તંત્રી)

સારું આરોગ્ય જાળવવા શું કરવું?

- ૧) ખાંડના ડબા બંધ કરીને દેશી ગોળ.
- ૨) આયોડીન નમક બંધ કરીને સિંઘવ મીઠું.
- ૩) મેંદો બંધ કરીને જવ, બાજરી, મકાઈ.
- ૪) રિક્કાઈન્ડ તેલ બંધ કરીને ઘાણીનું તેલ.
- ૫) ભેંસનું દૂધ બંધ કરીને દેશી ગાયનું દૂધ.
- ૬) ફીજનું પાણી બંધ કરીને માટલાનું પાણી.
- ૭) ટીવી બંધ કરીને રેડિયો (જુના ગીત કે ભજન કે સંગીત)
- ૮) વિલાયતી દવા બંધ કરીને દેશી દવા કે આયુર્વેદ.

૯) ઘરની અંદર ભરાઈ રહેવા કરતાં કુદરતના ખોળે રહો.

૧૦) હોટલનું ખાવાનું બંધ કરીને ઘરનું સાત્વિક ભોજન.

૧૧) રાત્રે વહેલા સુઈ ને સવારે વહેલા ઉઠો.

૧૨) ઠંડા પીણાં પીવાનું બંધ કરો લીંબુ શરબત કે ઓરીજનલ ફળોના રસ.

આ બાર નિયમોનું પાલન કરશો તો કોઈપણ રોગ આપની પાસે આવતાં સો વાર વિચાર કરશે.

ડૉ. રાજીવભાઈ દીક્ષિત પ્રેરિત જીવનશૈલી અપનાવો ને જીવનભર નિરોગી રહો.

કોરોના વાઈરસની ધાસ્તી

કીર્તિદા દલાલ

ચીનના વુહાન શહેરની મચ્છી માર્કેટથી ફેલાયેલા કોરોના વાઈરસનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા દિવસે વધતી જાય છે. ચીનથી થાઈલેન્ડ, નેપાળ, અમેરિકા અને ફ્રાંસ બાદ આ ઘાતક વાઈરસ આપણે ત્યાંપણ પગપેસારો કરી ચૂક્યા છે.

કોરોના વાઈરસ શું છે?

આ એક નવા પ્રકારના વાઈરસોનો સમૂહ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મત મુજબ આ વાઈરસ સી-કૂડ સાથે જોડાયેલા છે એ પ્રાણીઓમાં જોવા મળે છે. સૌથી પહેલાં ચામાચીડિયામાં જોવા મળ્યા હતા. પ્રાણીઓના સંપર્ક દ્વારા એ ફેલાય છે. સાર્સ અને મર્સ નામના વાઈરસ જે ૨૦૦૩ અને ૨૦૧૨માં જોવા મળ્યા હતા એને મળતાં આવે છે, પણ આ વાઈરસ નવાં પ્રકારના હોવાથી એ કઈ રીતે અસર કરશે એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. વળી એની ચોક્કસ સારવાર ન હોવાથી ઈલાજ પણ શક્ય નથી.

કોરોના વાઈરસનાં લક્ષણો

શરૂઆતમાં એના લક્ષણો ફ્લૂ જેવા જ છે. ખાંસી, શરદી, ગળામાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે થાય છે. ત્યાર પછી દર્દીને ન્યૂમોનિયા થાય છે. ભૂખ મરી જાય. પરસેવો, ઊલટી, ઠંડી લાગવી જેવા ચિહ્નો પણ જોવા મળે છે. અત્યારે આ વાઈરસ માટેની દવા ઉપલબ્ધ નથી, પણ ઉપર પ્રમાણેનાં લક્ષણો દેખાય તો તરત તબીબી મદદ લેવી જરૂરી છે. અને એટલો આરામ કરવો અને જાહેર સ્થળોએ જવાનું ટાળવું મોઢાં પર માસ્ક પહેરી રાખવો જેથી બીજાને ચેપ ન લાગે અને હેલ્પલાઈન પર સંપર્ક કરવો.

આપણે ડરવું જરૂરી?

અત્યારે આ વાઈરસ ભારતમાં ખાસ જોવા મળ્યા

નથી. આપણે ત્યાં ન ફેલાય એ માટે દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, બેંગલોર, હૈદરાબાદ, કોચી વગેરે એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. વિદેશી ખાસ કરીને ચીનથી આવતાં પ્રવાસીઓને પૂરતી શારીરિક તપાસ પછી જ ભારતમાં પ્રવેશ મળે છે.

વાઈરસથી બચવા આટલી સાવચેતી રાખવી

- આ વાઈરસ જે જગ્યાએ ફેલાય છે ત્યાં ન જવું.
- વધારે લોકો ભેગા થયા હોય એવી જગ્યાએ જવાનું ટાળવું.
- જાહેરમાં નાક અને મોઢું માસ્ક વડે ઢાંકેલા રાખવા.
- ઘર સ્વચ્છ રાખવું.
- હાથ વારંવાર સાબુથી ધોવા. સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરી શકાય.
- પ્રાણીઓના સંપર્કથી દૂર રહેવું.
- માંસાહાર ખાસ કરીને સી-કૂડ ખાવાનું ટાળવું.
- શરદી-ખાંસી ધરાવતી વ્યક્તિઓથી થોડું અંતર રાખવું.
- સમતોલ આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી નિંદ્રા જેવી સ્વાસ્થ્યવર્ધક આદત પાડી રોગપ્રતિકારક શક્તિ વધારવી.
- ફળો તેમ જ શાકભાજી પાણીથી ધોઈને ઉપયોગમાં લેવા.
- પાણી પૂરતાં પ્રમાણમાં અને થોડી થોડી વારે પીવું. હૂંફાળું ગરમ પાણી પીવાથી ફાયદો થાય છે.

તેલથી તરબરતા શાકમાં બે ઈંચ નીચે શાકે આત્મહત્યા કરી લીધી હોય છે

શાસ્ત્રો કહે છે કે માણસ હોય એ સંઘ્યા પહેલાં ખાઈ લે. આયુર્વેદ પણ આ જ કહે છે અને અન્ય પંથીના નિષ્ણાતો પણ આ જ કહે છે, જેનો સીધો અર્થ એવો છે કે રાતે ખાય એ રાક્ષસ કહેવાય અને એમ છતાં રાતે દોઢ વાગ્યે અને બે વાગ્યે ઘરે જઈને ખાનારાઓ આપણે જોયા છે. જે કોઈની નોકરી એ પ્રકારની છે એ લોકો તાત્કાલિક અસરથી આ વાતમાં સુધારો કરે. માત્ર લાંબું જીવવા માટે નહીં, પણ સારી અવસ્થામાં લાંબું જીવવા માટે. રાતે દોઢ વાગ્યે જમવા બેસવું એ તકલીફોને આમંત્રણપત્રિકા લખવા સમાન છે.

પેટની દરકાર કર્યા વિના અંકરાંતિયાની જેમ ખાનારાઓને જોતી વખતે ખરેખર એક વિચાર મનમાં ઝબકી જાય છે. એવા લોકો એવી રીતે ખાવા પર તૂટી પડે છે જાણે પોતે એ ખોરાક નહીં ખાય તો ખોરાક પોતાને ખાઈ જશે. આપણે ત્યાં કહેવાય છે, જે પોષતું એ મારતું. આવો ક્રમ બીજી કોઈ વાતમાં દેખાય કે નહીં, પણ અહીં ખાનપાનની બાબતમાં દેખાય છે - જે પોષતું એ મારતું.

જીભની પાસેથી કોદાળીનું કામ લેવામાં આવે છે અને એને કબર ખોદાવવાની જવાબદારી સોંપી દીધી છે. જીભ બહુ સમજદાર છે. પોતાનું કામ કરે પણ છે અને કરાવે પણ છે. જો ઈચ્છતા હો કે આ કામ જીભ ન કરે તો તમે સજાગ થઈ જાવ અને આરોગ્યના ત્રણ બેઝિક નિયમોનું પાલન શરૂ કરી દો. ખાસ કરીને ચાળીસી વટાવ્યા પછી. પહેલાં આ નિયમો સાઠ પછી પાળવાના હતા, પણ હવે ખાનપાન બદલાઈ ગયાં છે એટલે એમાં પણ ફેરફાર આવ્યા છે. હવે દિવસમાં ત્રણ વડાપાંઉ પેટમાં ઓરાઈ જાય છે

અને બે વખત લારી પર ઊભા રહીને પાણીપૂરી ખાઈ લેવામાં આવે છે. ચાળીસીએ પહોંચો એટલે સીધો નિયમ બનાવી લો.

ઝારું ચાલો, ઝારું ઊંઘો અને ઓછું ખાઓ. આપણે આ નિયમ તૂલી ગયા છીએ એવું નથી. આપણે આ નિયમને ઊંઘી રીતે પાળીએ છીએ. આપણે ઓછું ચાલીએ છીએ. ઓછું ઊંઘીએ છીએ. દોટ એટલી મોટી માંડી દીધી છે, હરીફાઈને એટલી પર્સનલ બનાવી દીધી છે કે ઊંઘ આવતી જ નથી અને આપણને વાંધો પણ નથી. ભવિષ્યની કુશાદે જિંદગી માટે આજે આપણે ઢસરડા કરીએ છીએ અને પછી, ઝાઝામાં ઝારું ખાઈએ છીએ.

એક સર્વે મુજબ, શહેરી સુખી માણસ એના શરીરની આવશ્યકતા કરતાં, શરીરની જરૂરિયાત કરતાં દસ ગણું ખાય છે. શરમની વાત એ છે કે આમાં ગુજરાતીઓ અગ્રીમ હરોળ પર છે. આમ તો આ વાત પેટ દેખાડી જ દે છે અને એ પછી પણ કહેવું પડે છે કે ખાવામાં આવતી આ બધી વાનગીઓને જીભ સાથે સીધો સંબંધ છે. કોઈ જાતની સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ ખાવી નથી. પતિ બિચારો કહીકહીને મરી જાય તોપણ ઘરમાં શાક નથી બનતું, તેલનું શાક બને છે. ઉપર તરતાં તેલની બે ઈંચ નીચે શાકભાજીના મૂતદેહ પડ્યા હોય છે અને બૈરી ખુશ થાય છે કે બિચારાને સારું ખાવાનું આપ્યું. જો આવું શાક મળતું હોય તો બૈરીની હાજરીમાં એક વખત કોઈ પણ પંથીના ડૉક્ટરને ઘરે બોલાવીને આ શાક જમાડજો, એ જે ભાષણ આપે એ બૈરી માટે રેકર્ડ કરીને રાખજો, જેથી એ નવેસરથી એવું જ ત્રાસદાયી શાક બનાવે તો એને સંભળાવી શકાય.

‘મિડ ૩’માંથી સાભાર

જુઓ, જગતની
અત્યારની પરિસ્થિતિમાં

એક જ ઉપાય

સંજોગો હંમેશાં મુશ્કેલ રહેવાના. સમગ્ર જગત એક લડાઈ, એક સંઘર્ષની પરિસ્થિતિમાં છે - અભિવ્યક્ત થવા ઈચ્છતી સત્ય અને પ્રકાશની શક્તિઓ અને તેની સામે જેને બદલાવું નથી, જે ભૂતકાળમાં જડતાપૂર્વક નિયત કરાયેલું છે, જે નમનીય ન રહેતાં કઠોર થઈ ગયું છે, જે જવાનો ઈનકાર કરે છે તે બધાનો વિરોધ. સ્વાભાવિક રીતે જ પ્રત્યેક વ્યક્તિને પણ તેની વ્યક્તિગત મુશ્કેલીઓનો અનુભવ થાય છે અને એવા જ અવરોધોનો સામનો કરવો પડે છે.

તમારા માટે માત્ર એક જ રસ્તો છે. એ છે સમગ્ર, સંપૂર્ણ અને બિનશરતી સમર્પણ. આ દ્વારા હું જે કહેવા માગું છું તે એ કે માત્ર તમારી ક્રિયાઓ, કાર્યો કે મહત્વાકાંક્ષાઓ જ નહીં, પરન્તુ તમારી લાગણીઓનો પણ ત્યાગ. તમે જે કંઈ કરો છો, તમે જે કંઈ છો તે બધું માત્ર પ્રભુ માટે જ. આમ કરવાથી તમે અનુભવ કરશો કે તમે આસપાસના માનવીય પ્રત્યાઘાતોથી ઉપર ઊઠો છો, માત્ર તેમની ઉપર ઊઠો છો એટલું જ નહીં, પરન્તુ પ્રભુકૃપાની દીવાલ તમારું રક્ષણ કરી રહી છે. એકવાર તમારી ઈચ્છાઓ નિ:શેષ થઈ ગઈ, એકવાર તમારી આસક્તિઓ નિ:શેષ થઈ ગઈ, એકવાર તમે જાણી લો કે પરમાત્મા પાસેથી પ્રાપ્ત થતો એક જ બદલો એવો છે જે ખરેખર પ્રાપ્ત કરવા જેવો છે અને એ ક્યારેય નિરાશ કરતો નથી તેમ જ એ જાણીને માનવો - પછી તે કોઈ પણ હોય - માનવી પાસેથી બદલો મેળવવાની બધી જ જરૂરિયાત જો તમે ત્યજી દો, એકવાર બહારની બધી જ વ્યક્તિઓ અને વસ્તુઓ તરફની આસક્તિ જો તમે છોડી દો, તો તરત જ તમે તમારા હૃદયમાં આ હાજરી, આ શક્તિ, આ કૃપાનો

અનુભવ કરશો જે હંમેશાં તમારી સાથે છે. બીજો કોઈ

ઉપાય નથી. એ એક જ ઉપાય છે, દરેકને માટે, અપવાદ વિના. જે લોકો દુ:ખ ભોગવી રહ્યા છે એ બધાને એક જ વસ્તુ કહેવાની છે: બધું જ દુ:ખ એ હકીકતની નિશાની છે કે સમર્પણ સંપૂર્ણ નથી. તેથી જ્યારે તમે તમારી અંદર 'ધડ' કરતો કોઈ આઘાત અનુભવો ત્યારે 'અરે, આ ખરાબ છે,' અથવા 'આ પરિસ્થિતિ મુશ્કેલ છે' એમ કહેવાને બદલે તમારે એમ કહેવું જોઈએ કે, 'મારું સમર્પણ સંપૂર્ણ નથી,' તો એ બરાબર ગણાય અને પછી તમે અનુભવશો કે કૃપા તમને મદદ કરી રહી છે અને દોરી રહી છે અને તમે આગળ જઈ રહ્યા છો અને એક દિવસ તમે એવી શાંતિમાં પ્રવેશ કરશો કે જેનો ભંગ કશાયથી પણ ન થાય. બધી જ વિરોધી શક્તિઓ, વિરોધી ગતિવિધિઓ, હુમલાઓ, ગેરસમજણો, દુરિચ્છાઓનો તમે એ જ સ્મિતથી જવાબ આપશો કે જે ભગવાનની કૃપામાં પૂરા વિશ્વાસમાંથી પ્રકટે છે અને એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ જગત છે સંઘર્ષનું, દુ:ખનું, મુશ્કેલીનું, થકવી નાખતા પરિશ્રમનું જગત, એ તેનું બનેલું છે. હજુ તે બદલાયું નથી, તેને બદલાતાં હજુ થોડો સમય લાગશે, પરન્તુ દરેકને માટે આમાંથી બહાર નીકળી જવાની શક્યતા છે - જો તમે ભગવાનની પરમકૃપાનો આશ્રય લો તો. માત્ર તે જ એક ઉપાય છે.

મનુષ્યો પાસેથી કદરની અપેક્ષા રાખશો નહીં, કેમકે, મનુષ્યોને ખબર જ નથી હોતી કે કોઈ વસ્તુની કદર કરવા માટે માપદંડ કયો રાખવો અને તેથી વધુ તો જ્યારે કંઈક તેમનાથી ચઢિયાતું હોય ત્યારે તેમને એ ગમતું હોતું નથી.

- 'જ્યોતિર્ગમય'માંથી સાભાર'

શ્રી સોરઠ વિશાશ્રીમાળી

જૈન સમાજ - મુંબઈ

ભેટની યાદી

સમાજને ભેટ

- ૨૫૧/- શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈને
- ૨૫૧/- મુખપત્રને ભેટના
- ૨૫૧/- ડૉ. શાંતિલાલ રતિલાલ કોરડિયા મેડીકલ રાહત ફંડમાં
- ૨૦૦/- ધીરજલાલ રાઘવજી મહેતા પરિવાર તરફથી પિતાશ્રી ધીરજલાલ રાઘવજી મહેતાના આત્મશ્રેયાર્થે
- ૨૫૦/- ધીરજલાલ ત્રિભોવનદાસ શાહ તરફથી ચિ. પલકના વેવિશાળ પ્રસંગે
- ૫૦૧/- હરેશભાઈ ધીરજલાલ માઝની તરફથી સુપુત્રી ચિ. હેમીતના લગ્ન પ્રસંગે
- ૫૦૧/- હેમંતભાઈ મહેન્દ્રભાઈ શાહ તરફથી ચિ. નિરાલીના લગ્નપ્રસંગે
- ૫૦૧/- ઉત્તમચંદ પાનાચંદ દોશી પરિવાર તરફથી પ્રવીણભાઈ ઉત્તમચંદ દોશીના આત્મશ્રેયાર્થે હ. હસમુખભાઈ

મુખપત્રને ભેટ

- ૨૦૦/- ધીરજલાલ રાઘવજી મહેતા પરિવાર તરફથી પિતાશ્રી ધીરજલાલ રાઘવજી મહેતાના આત્મશ્રેયાર્થે

- ૨૫૦/- ધીરજલાલ ત્રિભોવનદાસ શાહ તરફથી ચિ. પલકના વેવિશાળ પ્રસંગે
- ૫૦૧/- ઉત્તમચંદ પાનાચંદ દોશી પરિવાર તરફથી પ્રવીણભાઈ ઉત્તમચંદ દોશીના આત્મશ્રેયાર્થે હ. હસમુખભાઈ

આ યાદી તા. ૨૯-૨-૨૦૨૦ સુધીની છે.

શૈક્ષણિક સહાય

- ૫૦૧/- ઉત્તમચંદ પાનાચંદ દોશી પરિવાર તરફથી પ્રવીણભાઈ ઉત્તમચંદ દોશીના આત્મશ્રેયાર્થે હ. હસમુખભાઈ
- આ યાદી તા. ૨૯-૨-૨૦૨૦ સુધીની છે.

દીર્ઘાયુ થવું હોય તો દોસ્ત બનાવો - દોસ્તી પ્રગાઠ બનાવો

જો લાંબું જીવવું હોય તો દોસ્ત બનાવો અને મહત્તમ સમય એની સાથે વિતાવો. દોસ્તો સાથે રહો અને દીર્ઘાયુ થાઓ.

ઑસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોનું તારણ છે કે મિત્રો સાથે વધુ સમય ગાળનારા લોકો વધુ જીવે છે.

આનો અર્થ એ નથી કે કુટુંબીજનો સાથે સમય ગાળવો એ નુકસાનકારક છે. હા, એટલું જોવામાં આવ્યું છે કે એમ કરવાથી કોઈ રીતે દીર્ઘાયુ થવાતું નથી.

વૈજ્ઞાનિકો માને છે કે, મિત્રો સાથે સંકળાયેલા રહેવાથી આપણો મૂડ સારો રહે છે. આપણે આશાવાદી બની રહીએ છીએ. પ્રશ્નો ઉકેલવાની આપણી ક્ષમતા વધી જાય છે. એકંદરે આપણું સમગ્ર અસ્તિત્વ દીર્ઘાયુ ભોગવવા માટે અનુકૂળ થઈ રહે છે.

-ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનું તારણ

શ્રી સોરઠ વિશાશ્રીમાળી શુભેચ્છક મિત્ર મંડળ

શ્રી સોરઠ વિશાશ્રીમાળી શુભેચ્છક મિત્રમંડળમાં

આવેલ ભેટની યાદી

- ૨૫૦/- શ્રી ધીરજલાલ ત્રિભોવનદાસ શાહ તરફથી
તેમની પુત્રી પલકના વેવિશાળ પ્રસંગે
- ૨૦૦/- શ્રી ધીરજલાલ રાઘવજી મહેતા પરિવાર
તરફથી સ્વ. ધીરજલાલ રાઘવજી મહેતાના
આત્મશ્રેયાર્થે
- ૧૫૧/- શ્રી અશોકકુમાર ચીમનલાલ વોરા તરફથી
તેમની નવી જગ્યાના વાસ્તુ પ્રસંગે
- ૫૦૦/- શ્રીમતી વિમળાબેન પ્રભુદાસ મહેતા પરિવાર
તરફથી સ્વ. વિમળાબેન પ્રભુદાસ મહેતાના
આત્મશ્રેયાર્થે

શ્રી સોરઠ વિશાશ્રીમાળી શુભેચ્છક મિત્રમંડળમાં શ્રી તારાચંદ ધનજી મહેતા તબીબી રાહતમાં આવેલ ભેટની યાદી

- ૫૦૧/- શ્રી ઉત્તમચંદ પાનાચંદ દોશી પરિવાર તરફથી
સ્વ પ્રવીણાભાઈના આત્મશ્રેયાર્થે
હ. હસમુખભાઈ
- ૫૦૦/- શ્રીમતી વિમળાબેન પ્રભુદાસ મહેતા પરિવાર
તરફથી સ્વ. વિમળાબેન પ્રભુદાસ મહેતાના
આત્મશ્રેયાર્થે

શ્રી સોરઠ વિશાશ્રીમાળી શુભેચ્છક મિત્રમંડળમાં અનાજ વિતરણમાં આવેલ ભેટની યાદી

- ૫૦૧/- શ્રી ઉત્તમચંદ પાનાચંદ દોશી પરિવાર તરફથી
સ્વ. પ્રવીણાભાઈના આત્મશ્રેયાર્થે
હ. હસમુખભાઈ

૫૦૦/- શ્રીમતી વિમળાબેન પ્રભુદાસ મહેતા પરિવાર
તરફથી સ્વ. વિમળાબેન પ્રભુદાસ મહેતાના
આત્મશ્રેયાર્થે

શ્રી સોરઠ વિશાશ્રીમાળી શુભેચ્છક મિત્રમંડળમાં આર્થિક સહાયમાં આવેલ ભેટની યાદી

૫૦૦/- શ્રીમતી વિમળાબેન પ્રભુદાસ મહેતા પરિવાર
તરફથી સ્વ. વિમળાબેન પ્રભુદાસ મહેતાના
આત્મશ્રેયાર્થે

આ યાદી તા. ૨૮-૨-૨૦૨૦ સુધીની છે.

અવસાન નોંધ

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ

મોટી પાનેલી નિવાસી હાલ મુલુંડ શ્રી અજીતભાઈ
ભગવાનજી મહેતા ઉ. વ. ૭૭ તા. ૨૮-૨-૨૦૨૦ના
અરિહંતશરણ થયેલ છે. ચક્ષુદાન તેમ જ ત્વચાદાન કરેલ
છે.



મજેવડી નિવાસી હાલ મુલુંડ શ્રીમતી વિમળાબેન પ્રભુદાસ
મહેતા ઉ. વર્ષ ૮૦ તા. ૨૨-૨-૨૦૨૦ના અરિહંતશરણ
પામેલ છે.

શુભ લગ્ન

જુનાગઢ નિવાસી શ્રી કાન્તિલાલ વચ્છરાજ શાહની
દોહિત્રી તેમજ ઈલાબેન શાહની સુપુત્રી ચિ. મેઘનાના
શુભ લગ્ન ગોંડલ નિવાસી શ્રી હસમુખભાઈ દલીચંદભાઈ
કોરડિયાના સુપુત્ર ચિ. પ્રશાંતકુમાર સાથે મહા સુદ -
૧૦ ને મંગળવાર તા. ૪-૨-૨૦૨૦ના રોજ થયેલ છે.